

SPARC/Sec/SE/2025-26/16

July 10, 2025

BSE Limited.

P. J. Towers.

Market Operations Dept.

National Stock Exchange of India Ltd., Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block, Bandra Kurla Complex

Bandra Kurla Complex, Dalal Street, Bandra (East), Mumbai – 400 051. Mumbai - 400 001.

Scrip Symbol: SPARC Scrip Code: 532872

Dear Sir/ Madam,

Sub: Newspaper advertisement - 20th Annual General Meeting of the Company and other related information

This is to inform you that a public notice by way of an advertisement has been published in all the editions (English Language) of the Financial Express dated July 10, 2025 and in Ahmedabad Edition (Gujarati Language) of the Financial Express dated July 10, 2025, regarding notice of the 20th Annual General Meeting of the Company and other related information.

Pursuant to Regulation 30 read with Schedule III and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper which is also available on the website of the Company at https://sparc.life

This is for your information and records.

For Sun Pharma Advanced Research Company Limited

Kajal Damania
Company Secretary and Compliance Officer

Encl: As above

Responsible Care



Kotak Mahindra Bank Limited

CIN - L65110MH1985PLC038137 Registered Office: 27BKC, C 27, G Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Tel: +91-22-61660001, Fax: +91-22-6713 2403 Website: www.kotak.com, E-mail: KotakBank.Secretarial@kotak.com

NOTICE TO THE MEMBERS ABOUT THE FORTIETH ANNUAL GENERAL MEETING AND INFORMATION ON ELECTRONIC VOTING

The Fortieth Annual General Meeting ("AGM") of the members of Kotak Mahindra Bank Limited ("Bank") will be held on Saturday, 2nd August, 2025 at 10:00 a.m. (IST) through Video Conferencing ("VC"), in compliance with the provisions of the Companies Act, 2013 ("Act") and rules made thereunder read with relevant circulars issued by the Ministry of Corporate Affairs, to transact the business set out in the Notice of the AGM.

The Bank has availed services of National Securities Depository Limited ("NSDL"), to provide the VC facility for conducting the AGM. Members may attend / access the AGM by following the steps mentioned for 'Access to NSDL e-Voting System', in the Notice of the AGM. After successful login, members will be able to see 'VC' link placed under 'Join Meeting' menu against the Bank's name in Shareholder / Member login of NSDL's website at www.evoting.nsdl.com Members participating through the VC facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

In compliance with the relevant circulars, the Notice of AGM and the Integrated Annual Report 2024-25, comprising the standalone and consolidated audited financial statements for the financial year ended 31st March, 2025, along with Directors' Report and Auditors' Report and other documents required to be annexed thereto, have been sent on 9th July, 2025 to the members of the Bank whose e-mail address is registered with the Bank / Registrar and Transfer Agent of the Bank / Depository Participants ("DP") (in case of demat holding). A letter providing the following QR Code and the web-link, giving the exact path on the emplete details of the Notice of AGM and the Integrated ire available, has also been sent to those members who

| Annual Report 2 have not registe | 2024-25 are ava | ilable, has |
|----------------------------------|-----------------|-----------------------|
| Document | QR Code | |
| Notice of AGM | | https://v inv A |

ntegrated Annual

https://www.kotak.com/content/dam/Kotak/ investor-relation/Financial-Result/ Annual-Reports/FY-2025/ Report kotak-mahindra-bank/Kotak-Mahindra-2024-25 Bank-Limited-FY25.pdf

Web-link

https://www.kotak.com/content/dam/Kotak/ investor-relation/Financial-Result/

Annual-Reports/FY-2025/kotak-

mahindra-bank/agm-notice.pdf

The Notice of the AGM and the Integrated Annual Report are also available on the websites of the Stock Exchanges, namely, BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com, respectively, and the website of the e-voting service provider, namely, National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com

The documents referred to in the Notice of the AGM are available for inspection through electronic mode, without any fee, by the members, from the date of circulation of this Notice up to the date of AGM. Members seeking to inspect such documents can send an e-mail to KotakBank.Secretarial@kotak.com Information and instructions for remote e-voting and e-voting during AGM:

- In accordance with the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules. 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereo for the time being in force), the MCA Circulars and Regulation 44 of the SEBI Listing Regulations read with the circular of SEBI on e-voting Facility provided by Listed Entities dated 9th December, 2020, Secretarial Standard on General Meetings (SS-2) and any amendments thereto, the Bank is providing remote e-voting facility to all its members to enable them to cast their vote on the matters listed in the Notice by electronic means and business will be transacted through such voting ("e-voting") The Bank has engaged the services of NSDL for providing e-voting facility to its Eligible members, enabling them to cast their vote electronically, in
- The manner of e-voting / logging in the AGM by (a) individual members holding equity shares of the Bank in demat mode, (b) members other than individuals holding equity shares of the Bank in demat mode, (c) members holding equity shares of the Bank in physical mode and (d) members who have not registered their e-mail address, is explained in instructions, as provided in the Notice of the AGM.
- The remote e-voting facility shall be available during the following period · Commencement of remote e-voting: Tuesday, 29th July, 2025 (from 9:00 a.m. IST)
- End of remote e-voting: Friday, 1st August, 2025 (till 5:00 p.m. IST) The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period.
- (iv) The facility for e-voting shall also be made available to those members who will be present in the AGM through VC facility and have not cast their vote through remote e-voting.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC but shall not be entitled to cast their vote again.
- Only a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on Cut-off Date i.e., Saturday, 26th July, 2025, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. (vii) Voting rights of members shall be in proportion to their share in the
- paid-up equity share capital of the Bank as on the Cut-off Date, subject to applicable laws, including the Banking Regulation Act, 1949.
- (viii) Every Folio / Client ID will have only one login-ID irrespective of the
- (ix) Any person who becomes a member of the Bank after the Notice is sent and holds shares as of the Cut-off date, i.e., Saturday, 26th July, 2025, may obtain the user ID and password for e-voting by sending a request at evoting@nsdl.com However, if such person is already registered with NSDL for remote e-voting, then such person may use the existing user ID and password for casting vote.
- If any member has forgotten the user ID and / or password, the same can be reset by using 'Forgot User Details / Password' or 'Physical User Reset

Password' option available on www.evoting.nsdl.com

In case of any query / grievances related to the facility of remote e-voting / voting by electronic means of if members need any assistance before or during the AGM, such member may refer to the Frequently Asked Questions ("FAQs") for members and e-voting user manual for members available in the download section of www.evoting.nsdl.com

PROCEDURE FOR (i) REGISTRATION OF E-MAIL ADDRESS FOR OBTAINING THE NOTICE OF AGM. INTEGRATED ANNUAL REPORT 2024-25 AND THE USER ID / PASSWORD FOR E-VOTING / ATTENDING THE AGM AND (ii) UPDATION OF BANK ACCOUNT MANDATE FOR RECEIPT OF DIVIDEND IS, AS BELOW:

| Type of Holding | Procedure |
|------------------|--|
| Physical Holding | For registration of e-mail address and / or updation of |
| | Bank Account details, please send a written request |
| | in Form ISR-1 (available at https://www.kotak.com/ |
| | en/investor-relations/investor-information/ |
| | investor-info.html) to the RTA of the Bank, i.e., KFin |
| | Technologies Limited at Selenium Tower B, Plot 31-32, |
| | Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad |
| | – 500 032 (Unit: Kotak Mahindra Bank Limited), providing |
| | Folio Number, name of the member, copy of the share |
| | certificate (front and back), PAN (self-attested copy of |
| | PAN card) and AADHAAR (self-attested copy of Aadhaar |
| | card). Additionally, please provide a self-attested copy of a |
| | cancelled cheque leaf bearing the name of the first holder |
| | / bank statement duly attested by the Bank Manager |
| | (along with the details of 9-digit MICR Code Number and |
| | 11-digit IFSC), for updating bank account details. |
| Demat Holding | Please contact your Depository Participant ("DP") and register your e-mail address and bank account details in your demat account as per the process advised / forms |
| | your demat account, as per the process advised / forms |

made available by your DP.

Mumbai, 9th July, 2025

For KOTAK MAHINDRA BANK LIMITED

Avan Doomasia Company Secretary (FCS 3430)

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Navin Fluorine International Limited

Regd. Office: Office No. 602, Natraj by Rustomjee, Near Western Express Highway, Sir Mathuradas Vasanji Road, Andheri (East), Mumbai 400069, India Tel. No. + 91 22 6650 9999 | Fax No. +91 22 6650 9800 Website: www.nfil.in | E-mail: investor.relations@nfil.in CIN: L24110MH1998PLC115499



THIS NOTICE is with reference to the Notice published on July 9, 2025 in the newspapers viz. Financial Express and Loksatta regarding the 27th Annual General Meeting ('AGM/Meeting') of the Company which is scheduled to be held on Thursday, July 31, 2025 at 3.00 p.m. (IST) through Video Conferencing ('VC')/Other Audio Visual Means ('OAVM'). to transact the Business Items as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with the rules made thereunder ('the Act') and General Circular of the Ministry of Corporate Affairs ('MCA') dated September 19, 2024 and other applicable General Circulars (collectively referred as 'MCA Circulars').

In accordance with the MCA Circulars and the relevant provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual Report for the financial year 2024-25, including the AGM Notice and e-voting instructions, has been sent electronically today i.e. on July 9, 2025, to all Members whose e-mail IDs are registered with the Company/the Company's Registrar and Share Transfer Agent viz. KFin Technologies Limited Depository Participants unless any Member has requested for a physical copy. A letter containing the web-link of the Annual Report has been sent to Members who have not registered their e-mail Ids. The Annual Report, including notice of AGM, is also available on the website of: 1) the Company at https://www.nfil.in/investor/annu reports.html, 2) BSE Limited at www.bseindia.com, 3) National Stock Exchange of India Limited at www.nseindia.com and 4) National Securities Depository Limited ('NSDL') at www.evoting.nsdl.com. By order of the Board of Directors

For Navin Fluorine International Limited

Date: July 09, 2025 Place: Mumbai



Niraj B. Mankad President Legal & **Company Secretary**

THE BUSINESS DAILY **FOR DAILY BUSINESS**

***FINANCIAL EXPRESS**



GUJARAT HOTELS LIMITED

Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2025 (₹ in lakhs)

| | Particulars | 3 months ended 30.06.2025 | | Corresponding 3 months ended 30.06.2024 |
|---|--|---------------------------------|----------|---|
| T | Total Income from Operations | 186.39 | 744.75 | 145.08 |
| T | Net Profit / (Loss) for the period | | - | |
| | (before Tax, Exceptional and/or | | | |
| | Extraordinary items) | 173.86 | 693.90 | 133.72 |
| | Net Profit / (Loss) for the period | | | |
| | before tax (after Exceptional and/or | | | |
| | Extraordinary items) | 173.86 | 693.90 | 133.72 |
| | Net Profit / (Loss) for the period after tax | | | |
| | (after Exceptional and/or Extraordinary | | | |
| | items) | 140.43 | 529.87 | 125.29 |
| T | Total Comprehensive Income for the period | | | |
| ı | [Comprising Profit / (Loss) for the period | | | |
| | (after tax) and Other Comprehensive | | | |
| 1 | Income (after tax)] | 140.43 | 529.87 | 125.29 |
| I | Equity Share Capital | 378.75 | 378.75 | 378.75 |
| | Reserves Excluding Revaluation Reserve | | 4,469.95 | |
| T | Earnings Per Share (of ₹ 10/- each) | | | |
| ı | a) Basic (₹) | 3.71 | 13.99 | 3.31 |
| | b) Diluted (₹) | 3.71 | 13.99 | 3.31 |

a) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and this extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the meeting held on 9th July 2025. The full format of the Statement of Unaudited Financial Results are available on the Company's website (www.gujarathotelsltd.in) and on the website of the BSE Limited (www.bseindia.com).

The Limited Review, as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed and the related Report forwarded to the Stock Exchange. This Report does not have any impact on the above 'Results and Notes' for the Quarter ended 30th June, 2025 which needs to be explained.

Registered Office:

WelcomHotel Vadodara, R.C.Dutt Road, For and on behalf of the Board Alkapuri, Vadodara-390007 **Date:** 9th **July 2025** Rishabh Punjabi **Anil Chadha** Place: New Delhi, India Chief Financial Officer Chairman

Phone: 0265-2330033 | Fax: 0265-2330050 | CIN: L55100GJ1982PLC005408

BENGAL & ASSAM COMPANY LIMITED NOTICE

Transfer of Equity Shares of the Company to IEPF Shareholders are hereby informed that pursuant to Section 124 (6) of the

Companies Act, 2013 read with amended Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("IEPF Rules"), all shares in respect of which dividend declared for the financial year 2017-18 has not been paid or claimed by the Shareholders for 7 (Seven) consecutive years or more shall be transferred by the Company to the Investor Education and Protection Fund Authority (IEPF Authority).

Individuals notices has been sent to all the respective Shareholders at their latest available addresses in the Company's record interalia providing the details of shares liable to be transferred for taking appropriate action. The full details of such shareholders is available on the Company's website at www.bengalassam.com.

The concerned Shareholders are requested to claim the unclaimed dividend from the Company on or before 27th August, 2025 failing with which their shares shall be transferred to IEPF Authority without any further Notice. However, the Shareholders would be entitled to claim the shares from IEPF Authority by making an Application in Form IEPF-5, as prescribed under the IEPF Rules, which is available on IEPF website i.e. www.iepf.gov.in.

In case of any query related to IEPF, Shareholders may contact the

Company at dswain@jkmail.com or ajay.tiwari@jkmail.com or RTA at

Shareholders may also note that, as mandated by SEBI, the Company had sent several Reminders to all the Shareholders holding shares in physical form, requesting them to furnish their KYC and other details in the prescribed Forms (ISR-1, 2, 3, SH-13 and 14, available on the website of the Company www.bengalassam.com) to the Company's Registrar and Share Transfer Agent (RTA). In case, you have not submitted the required details so far, we once again request you, in your own interest, to immediately send these details to our RTA at its Office at Alankit Assignments Limited,

Alankit House, 4E/2, Jhandewalan Extension, New Delhi - 110055 or E-mail



to ramap@alankit.com.

ramap@alankit.com

For Bengal & Assam Company Limited Dillip Kumar Swain Company Secretary

Corporate Identity Number: L67120WB1947PLC221402 Website: www.bengalassam.com, Email: dswain@jkmail.com Regd. Off.: 7, Council House Street, Kolkata - 700001, West Bengal Tel.: 033 - 22486181/22487084, Fax: 033 - 22481641

For Kind Attention of Shareholders: As a part of Green Initiative of the Government, all the Shareholders are requested to get their e-mail addresses registered with the Company, for receiving Annual Report etc. on e-mail.



Telangana- 500034, Contact No. 040-35359999 / 2525 9999 maii :compilanceofficer@smspharma.com, cs@smspharma.com | Web: www.smspharma.com NOTICE TO SHAREHOLDERS – TRANSFER OF SHARES TO INVESTOR EDUCATION PROTECTION FUND (IEPF) Notice is given pursuant to Section 124(6) of the Companies Act, 2013, read with

Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as amended from time to time, providing for transfer of the Equity Shares to IEPF in respect of which the dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more to the IEPF Account established by the Central Government, The unclaimed dividend for the year 2017-2018 and the shares in respect of which the

dividend are unpaid/unclaimed for a period of seven consecutive years are due to be transferred to IEPF during the FY 2025-2026. A list of such shareholders, who have not encashed their dividends for seven consecutive years and whose shares are therefore liable for transfer to the IEPF account, is displayed on the website of the Company at www.smspharma.com under the section "Investors". The Company has sent individual communication to the concerned shareholders

whose shares are liable to be transferred to IEPF account as per the said rules for taking appropriate action and submitting requisite documents to claim the shares and unpaid dividend amount(s) before its credit to the IEPF Account. In case the Company does not receive any communication from the concerned shareholders on or before October 05th, 2025, the Company shall with a view to complying with the requirements set out in the Rules, transfer the shares to the IEPF Account by the due date as per the procedure stipulated in the Rules. Notice is further given that in the absence of receipt of a valid claim by the shareholder, the

Company shall transfer the said shares to IEPF Account without further Notice in accordance to the requirements of the said rules, no claim shall lie against the Company or RTA. Please note that subsequent to such transfer, all future benefits which may accrue thereunder including future dividends, if any, will be credited to the IEPF. Further, the shareholders may kindly note that after the above referred transfer is made,

refunds from the IEPF can be claimed only by complying with the provisions of Rule 7 of the IEPF Rules i.e., by submitting an online application in a prescribed web Form IEPF-5 available on the website: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html For any information / clarifications on this matter concerned shareholders may write to

the Company at cs@smspharma.com or contact the Company's Registrar and Share Transfer Agent - M/s. Aarthi Consultants Private Limited, # 1-2-285, Domalguda, Hyderabad, Telangana – 500029, Ph: 040-27638111, Info@aarthiconsultants.com

Place: Hyderabad

For SMS Pharmaceuticals Limited

Thirumalesh Tumma Company Secretary

SUN PHARMA ADVANCED RESEARCH COMPANY LIMITED CIN: L73100GJ2006PLC047837

Registered Office: Plot No. 5&6/1, Savli G.I.D.C. Estate, Savli - Vadodara Highway, Manjusar - 391775 Tel: +91 02667 666800

Corporate Office: 17/B, Mahal Industrial Estate, Mahakali Caves Road, Andheri East, Mumbai 400 093, Maharashtra Tel: +91 22 6645 5645 Fax: +91 22 6645 5685 Website: www.sparc.life Email: secretarial@sparcmail.com

NOTICE OF 20™ ANNUAL GENERAL MEETING This is to inform that the Twentieth (20th) Annual General Meeting of the Members of

the Company will be held on Tuesday, August 12, 2025 at 04:00 P.M. ("AGM") through Video Conferencing ("VC"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 read with enabling circulars issued by the Ministry of Corporate The Notice of 20" AGM along with the Annual Report for the financial year 2024-25

will be sent by electronic mode to all the members whose email addresses are registered with the Company's Registrar and Transfer Agent, MUFG Intime India Private Limited ("RTA")/ Depositories. Members holding shares in dematerialized form are requested to register their email address and mobile number with their Depository Participants, and members holding shares in physical form are requested to register details of their email address and mobile number on the website of the RTA at https://web.in.mpms.mufg.com and for any clarification you may contact to RTA at rnt.helpdesk@in.mpms.mufg.com . The Notice of 20th AGM along with the Annual Report for the financial year 2024-25 shall also be available on the website of the Company at https://sparc.life/ and on the websites of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and the National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com. being the agency appointed by the Company for providing e-voting facility. Members will have an opportunity to cast their votes remotely on the business as set

forth in the Notice of the 20" AGM through remote e-voting. The manner of remote evoting for members holding shares in dematerialization form, physical form and members who have not registered their email addresses will be provided in the Notice of the AGM. The facility for e-voting will also be provided at the AGM, and members attending the AGM, who have not cast their votes by remote e-voting, will be able to

It is important to note that as per the SEBI circular dated 10th June 2024, members with securities held in physical form must update their KYC, including the PAN, Contact Details, Nomination, Bank Account Details, and Specimen Signature.

For Sun Pharma Advanced Research Company Limited Kajal Damania

Place: Mumbai Date : July 09, 2025 Company Secretary and Compliance Officer ICSI Membership No. 29764

0.20

Year Ended

Audited)

5,234.36

751.67

597.71

Quarter Ended

(Unaudited)

30 June 2025 31 March 2025 31/Mar/2025

Audited)

e vedanta

Place: Delhi

Date: July 10, 2025

HINDUSTAN ZINC LIMITED

Regd Office: Yashadgarh, Yashad Bhawan, UDAIPUR-313 004 (Rajasthan) Email: hzl.secretarial@vedanta.co.in website: www.hzlindia.com Tel: +91:2946604000-02



Date: 09.07.2025

HINDUSTAN ZINC Zinc & Silver of India

PUBLIC NOTICE TO THE MEMBERS - 59" ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the fifty-ninth (59") Annual General Meeting ("AGM") of the Members of the Company is scheduled to be held on Tuesday, August 05, 2025 at 12:00 Noon (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as set forth in the Notice convening the Meeting ("Notice") which would be circulated in due course of time.

Pursuant to General Circular No. 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate Affairs ("MCA") read together with other previous Circulars issued by MCA in this regard and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by the Securities and Exchange Board of India ("SEBI") read together with other previous Circulars issued by SEBI in this regard (hereinafter collectively referred to as "the Circulars"), companies are allowed to convene the AGM through VC or OAVM without physical presence of the Members at a common venue till September 30, 2025. Accordingly, the AGM of the Company is being held through VC/OAVM.

Annual Accounts of the Company for FY 2025 ("Integrated Annual Report") electronically to all its members whose e-mail IDs are registered with the Company/Depository Participants ("DPs"). A letter providing the weblink, including the exact path for accessing the Integrated Annual Report for the Financial Year 2025 will be sent to all these members who have not registered their e-mail ID. Members may note that the Integrated Annual Report and the Notice will be made available on the

In accordance with the Circulars, the Company will send the Notice along with the Integrated Report and

website of the Company at www.hzlindia.com, the website of the Stock Exchanges, i.e., BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and also on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com. Members holding shares in physical mode, who have not registered/updated their e-mail ID and who wish to receive the Notice, Integrated Annual Report and all other communications by the Company, from time to time, may get their e-mail IDs registered by submitting Form ISR-1 to KFin Technologies

Limited ("KFin"), the Registrar & Share Transfer Agent ("RTA") of the Company, at einward.ris@kfintech.com or to the Company at hzl.secretarial@vedanta.co.in. However, for the shares held in demat mode, Members are requested to write to their respective DPs. Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated May 07, 2024, all the Members holding shares in physical mode are mandatorily required to furnish/update their e-mail ID, Mobile Number, PAN and other KYC details through Form ISR-1, to update specimen signature through Form ISR-2, to furnish the Nomination as provided in Rule 19(1) of the Companies (Share Capital and Debentures) Rules, 2014 through Form SH-13 or to opt out from giving the Nomination through Form ISR-3 and to change the Nomination through Form SH-14. These forms are also available on the website

of the Company at KYC Forms | Hindustan Zinc (hzlindia.com), SEBI has mandated for all companies to

utilize the bank account details as furnished by the Depositories and as maintained by the RTA for

payment of dividend electronically to Members Members may note that, all security holders (holding securities in physical form), whose folio(s) do not have PAN or Contact Details or Mobile Number or Bank Account Details or Specimen Signature updated, shall be eligible for any payment including dividend, interest or redemption in respect of such folios, only through electronic mode with effect from April 01, 2024 and upon complying with the PAN, and KYC requirements to enable the Members to receive the dividend at the earliest, the Members holding shares in physical mode are requested to update their KYC details by submitting various ISR Forms to KFin as mentioned above. In accordance with the above, dividends, in respect of physical folios wherein any of the KYC details are not updated, will be held back by the Company. Members may please note that the dividends will get credited to their bank account only after the KYC details are updated in the folio.

The Members can join and attend the AGM through VC/OAVM facility only or view the live webcast of the proceedings. The detailed procedure for e-voting and participation in the AGM through VC/OAVM or to view the live webcast will be provided in the Notes to the Notice. The Members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again. Those Members who participate in the AGM through VC/OAVM and have not casted their vote through remote e-voting may cast their vote during the AGM. The above information is being issued for the information and benefit of all the members of the

Company and in compliance with the MCA and SEBI Circulars as amended from time to time.

For Hindustan Zinc Limited Aashhima V Khanna Company Secretary and Compliance officer Membership No.: ACS 34517

UMIYA

2. Diluted : Rs.

Date: July 09, 2025

Place: Mumbai

Key numbers of Unaudited Standalone Financial Results

UMIYA BUILDCON LIMITED (Formerly MRO-TEK Realty Limited)

Regd Office: No.6, 'Maruthi Complex', New BEL Road, Chikkamaranahalli, Bengaluru-560 054 Phone: 080-29911217 | Website: www.mro-tek.com | CIN NO.L28112KA1984PLC005873

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE **QUARTER ENDED 30TH JUNE. 2025**

| - 22 | Y. | 55 | | Rs.in Lakh | | |
|------|---|-----------------------------|----------------------------|--------------------------|--|--|
| | Particulars | | CONSOLIDATED RESULTS | | | |
| SI. | | | Quarter Ended | | | |
| No. | | 30 June 2025 (Unaudited) | 31 March 2025 (Audited) | 31/Mar/2025 (Audited) | | |
| 1 | Total income from operations | 5,415.69 | 1,372.90 | 5,137.21 | | |
| 2 | Net Profit / (Loss) for the period before Tax, Exceptional and Extraordinary Items | 3,855.78 | 67.65 | 749.86 | | |
| 3 | Net Profit / (Loss) for the period before Tax, but after Exceptional and Extraordinary Items | 3,855.78 | 67.65 | 749.86 | | |
| 4 | Net Profit / (Loss) for the period after Tax, after Exceptional and Extraordinary Items | 3,143.38 | 32.90 | 583.94 | | |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) | 3,144.93 | 22.76 | 577.32 | | |
| 6 | Equity Share Capital | 934.23 | 934.23 | 934.23 | | |
| 7 | Other Equity | 9,703.34 | 6,558.38 | 6,558.38 | | |
| 8 | Earnings Per Share (of Rs. 5/-each) for Continuing and discontinued Operations | 3 | | | | |
| | 1. Basic: Rs. | 16.82 | 0.20 | 3.17 | | |

5,211.06 1 Turnover 1,467.63 2 Net Profit / (Loss) for the period before Tax 3 Net Profit / (Loss) for the period after Tax, 3,139.25 86.00 Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Reg. 33 of the SEBI (LODR) Regulations 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchanges www.bseindia.com and www.nseindia.com. The same is also posted on the website of the company, "www.mro-tek.com".

Particulars

For UMIYA BUILDCON LIMITED Place : Bengaluru Date : 8th July 2025 Aniruddha Mehta

Chairman and Managing Director

NOTICE

Motilal Oswal Financial Services Limited SEBI Registration No.: INZ000158836

Member of Multi Commodity Exchange of India Limited (MCX); Member ID 55930, BSE Limited (BSE) Clearing No.: 446, National Stock Exchange of India Ltd (NSE) Member ID 10412 (NCDEX) ID 1240 Registered office Address of Member: Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opposite Parel ST Depot,

Prabhadevi, Mumbai - 400 025, Tel No.: 022-7193 4200 This is to inform all concerned that we have initiated the process of cancellation of registration of our below mentioned Authorised Person (AP) due to regulatory reasons/concerns.

| Exchange | Name of AP | Trade Name of AP | Address of AP | AP Registration No. |
|----------|--------------------|------------------|---|---------------------|
| MCX | AMAN UMESH SONI | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST, THANE, MAHARASHTRA, INDIA, 421201. | MCX/AP/156333 |
| BSE | AMAN UMESH SONI | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST, THANE, MAHARASHTRA, INDIA, 421201. | AP01044601146987 |
| NSE | AMAN UMESH | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, | AP0297504931 |

LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST,

THANE, MAHARASHTRA, INDIA, 421201.

Any person dealing with the above-mentioned Authorised Person henceforth shall do so at their own risk. Motilal Oswal Financial Services Limited shall not be liable for any dealings with the said entity post the issuance of this notice. Investors having any queries or concerns regarding this matter are requested to contact Motilal Oswal Financial Services Limited within 15 days from the date of issuing this notice.

For Motilal Oswal Financial Services Limited

Authorised Signatory

epaper.financialexpress.com



એઆરટી હાઉસિંગ ફાયનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ ART

ા. નવી દિલ્હી–૧૧૦૦૩૪

સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ નોટીસ એઆરટી હાઉસિંગ કાચનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ, સરકૈસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૨(૧) (એમ) (૪) હેઠળ કાચનાન્સિયલ ઇન્સ્ટીટયુશન, જે તેની રજસ્ટર્ડ ઓકીસ્ ૧૦૭, બેસ્ટ સ્કાય ટાવર, નેતાજી સુભાષ પેલેસ, પ્રિતમપુરા, દિલ્હી–૧૧૦૦૩૪ ખાતે ધરાવે છે (અહીં પછી સિક્યોર્ડ લેણદાર તરીકે દર્શાવેલ છે) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ, નીચેના લોન એકાઉન્ટ નંબરમાં માંગણા નોટીસ બજવી છે જેમને **૦૬.૦૭.૨૦૨૫ નાં રોજ એનપીએ** તરીકે વર્ગીકૃત કરાચેલ છે.

| ક્રમ નં. | લોન એકાઉન્ટ નંબર | દેવાદાર/ સહ–દેવાદારનું નામ | દેવાદાર/ સહ-દેવાદારનું સરનામું | સિક્યોર્ડ મિલકતનું સરનામું | માંગણા નોટીસ ૧૩(૨) ની તારીખ | બાકી રકમ | |
|-------------|--|--|---|--|--------------------------------|---|--|
| ď | LNRJT00123- 240009457 | જયરાજ ભુપતભાઇ મકવાણા અને મકવાણા વનિતાબેન ભુપતભાઇ અને સ્વ. મેસર્સ કાજલ ભુપતભાઇ મકવાણા | ન્યુ શાંતિદામ ૨, જયશ્રી સ્કુલ પાસે, ટેનામેન્ટ, વેરાવળ શાપર, રાજકોટ, બ્લોક નં. ૩, એસઆઇડીસી સેડ, રાજકોટ, ગુજરાત- ૩૬૦૦૨૪ અને વણક્કવાસ ટેનામેન્ટ જુનાગઢ ગોતાણા જુનાગઢ, ગુજરાત- ૩૬૨૨૫૦ | રેસિકેન્સીચલ ફલેટ નં. બી-૨૦૩, બીજો માળ, ચુનિટ-બી, બિલ્ટ અપ એરિચા ક્ષેત્રફળ ૩૮-૬૧ શો.મી., 'બાલાજી ફલેટ' તરીકે જાણીતો એરિચા, રેવન્થુ સર્વે નં. ૧૨૯ અને ૧૩૦ પૈકી, 'શાંતિદામ-૨' તરીકે જાણીતો એરિચા, સાઇટનાં બાંધકામ કુલ જમીન એરિચા, ક્ષેત્રફળ ૧૦૧૯-૧૫ શો.મી., પ્લોટ નં. ૨૨૨ થી ૨૩૩ અને ૪૦૫ થી ૪૦, ગામ-મુકામ-ગામ-રાજકો, તાલુકો-જિલો–રાજકોર, ગુજરાત ખાતેની મિલકત | | રા. ૯,૦૬,૨૬૮/– (રૂપિયા નવ લાખ છ હજાર બરસો અડ્સઠ પુરા) ૦૩.૦૩.૨૦૨૫ મુજબ | |
| DHIS | આગી નોટીસીઓને આ નોટીસની વારીખર્શી દુવાસની અંદર ઉપર જગાતેલ રહ્યા સહવવા માટે જગાવવામાં આતે છે. જેમાં નિષ્કળ જતાં અહી | | | | | | |

જણાવેલ સિક્ચોર્ડ એસેટોમાં આપેલ સિક્ચોર્ડ મિલકતો સામે સિક્ચોરીટી હિતને ટાંચમાં લેવાના હકનો ઉપયોગ કરવાની ફરજ પડશે. આ નોટીસ એએચએકએલને પ્રાપ્ત અન્ય કોઇપણ ઉપાયો પ્રત્યે પૂર્વગ્રહ વગરની છે.

સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની ૧૩ ના પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે. તારીખ : ૧૦.૦૭.૨૦૨૫ સહીં/- અધિકૃત અધિકારી રથળ : રાજકોટ (ગુજરાત) એઆરટી હાઉસિંગ ફાયનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ

| ઈ–હરાજી સહ વેચાણની જાહેર નોટીસ (પરિશિષ્ટ–૪ એ) (નિયમ ૮(૬)) |
|--|
| માઇએફએલ હોમ ફાચનાવ્ય લીમીટેડ (અગાઉ ઇન્ડિયા ઇન્ફોલીન હાઉસિંગ ફાચનાન્ય લીમીટેડ તરીકે જાણીતી) (આઇઓઇએફએલ-એચએફએલ) કોર્પોરેટ ઓફીસ ાયોટ તે. ૮૮, ઉદ્યોગ પેહાર, ફેઝ-૪, ગુટગાંત વરરુગપ (હિંગ્સાણ), શાખા ઓફીસ: શાખા ઓફીસ: મહેલો માત, થોમ બં. ૧૦, સિંગ માં ઘાઝા, અમર જવાન સર્વલ, નિકોલ, હઠવાડા રોડ, નિકોલ, અમદાવાદ, પુજાતન-૩૮૩૧૫૦ /પાંચામો માળ, ૫૦૮, ૫૦૯, અએક્સ લે ળિઝનેસ હત્ય કે જેપોલીટેકનિક લેબેજ સામે, ભોલાવ, ભરૂચ, ગુજના-૩૨૦૦૦ /અમદાવાદ કોમર્સ હાઉસ, ત્રોથો માળ, કોમર્સ હાઉસ ૧, શેલ પેઢ્રોલ પંપા પાસે, આનંદનગર રોડ, પ્રહાદનગર, અમદાવાદ-૩૮૦૦૫ વ ગોરો કરાયેલ રથાવર મિલકતોનું સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાબ્સિયલ એસેટ્સ અને મેન્ફોસેમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટર, ૨૦૦૨ (અહીં પછી એક્ટ તરીકે દર્શાવેલ છે) હેઠળ તેચાણ. આથી આઇઆઇએફએલ-એસએકએનિક અહિકારી (એઓ) એ નીચેના ત્રોને એકાઉન્ટોપોર્સિસ્ટ નંબરોમાં એક્ટની કલવ વર્શ, ટેલ જાત વર્શક ક્યાયેલ છે) હેઠળ તેચાણ. આથી આઇમાઇએફએલ-એસએકએલની ભારી કરમની વસુવાલ માટે જ્યાં છે, "જે છે" અને " કોઇ આશ્રય વિના" ના દોરણે તેના વેચાણના હક સાથે લઈ લીકેલ છે. વેચાણ નીસે સહી કરનાર દ્વારા વેબસાઇટ www.iiflonehome.com ઉપર પુરા પડાયેલ ઇ- |
| |

| દેવાદાર(રો)/ | માંગણા નોટીસની | સ્થાવર મિલકત /મિલકતોની | ભૌત્તિક | રિઝર્વ કિંમત |
|--|---|--|---|--|
| સહ-દેવાદાર(રો)/ | તારીખ અને રકમ | વિગત / સિક્યોર્ડ એસેટ | કળજાની તારીખ | ३।. ६०५०००/− |
| જામીનદાર(રો) | २४-०९-२०२४ ३।. ९०३૯७६७/- | પ્લોટ નં. એ/રદ્દ, શુભમ પાર્ક સોસાચટી, સર્વે નં. ૨૮૩, | | (રૂપિયા છ લાખ પાંચ હજાર પુરા) |
| શ્રી સંજય જમુના ચાદવ, શ્રીમતી આલ્ફા દેવી | (રૂપિયા દસ લાખ ઓગણચાલીસ હજાર સાતસો સડ્સઠ પુરા) | ગામ–સંજલી,તાલુકો–અંકલેશ્વર,જિલો–ભરૂચ,ગુજરાત– ૩૯૪૧૧૫ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. એરિચા ક્ષેત્રફળ (ચો. ફુટ) : મિલકતનો પ્રકાર : જમીન | કુલ બાકી સ્કમ તારીખ ૧૧–૦૬–૨૦૨૫ મુજબ રૂા. ૧૨૩૯૨૮૮/– (રૂપિયા બાર | અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂા. ૬૦૫૦૦/– (રૂપિયા સાહીઠ |
| (પ્રોસ્પેક્ટ નં. આઇએલ૧૦૨૦૩૬૦૭) | િઝડ વૃદ્ધિની રકમ રૂા. ૨૦૦૦૦/– (રૂપિયા વીસ હજાર પુરા) | એરિચા, કાર્પેટ એરિચા, બિલ્ટ અપ એરિચા, સુપર બિલ્ટ અપ એરિચા : મિલકત એરિચા : દૃ૪૩.૦૦, ૫૬૦.૦૦, ૨૫૨.૦૦, ૫૧૦.૦૦ (એરિચા ક્ષેત્રફળ ૪૨૦ ચો. ક્રુટ) | લાખ ઓગણસાલીસ હજાર બસ્સો ઈઠયાંશી પુરા) | હજાર પાંચસો પુરા) |
| શ્રી વિજ્યભાઇ કલાજી ચૌહાણ, મેસર્સ અમુલ શક્તિ પાર્લર, શ્રીમતી | ૧૦–૧૦–૨૦૨૪ રૂા. ૧૦૬૯૭૦૫/– (રૂપિયા દસ લાખ ઓગણસીતેર હજાર સાતસો પાંચ પુરા) | મિલકત નં. ૮૭૧, ઠાકોર વાસ, ગામ–કાડાદરા, તાલુકો– દહેગામ, ગાંદીનગર, ગુજરાત–૩૮૨૩૦૫ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. એરિયા ક્ષેત્રફળ | | રૂા. ૯૨૬૦૦૦/– (રૂપિયા નવ લાખ છવ્વીસ હજાર પુરા) |
| સંગીતાબેન વિજ્યભાઇ ચૌહાણ (પ્રોસ્પેક્ટ નં. ૯૬ <i>૭</i> ૫૩૨) | બિડ વૃદ્ધિની સ્ક્રમ રૂા. ૨૦૦૦૦/– (રૂપિયા વીસ હજાર પુરા) | (રો. કુટ): મિલકતનો પ્રકાર : બિલ્ટ અપ એરિયા, કાર્પેટ એરિયા, મિલકત એરિયા : ૧૦૨૦.૦૦, ૮૮૮.૦૦ | રૂા. ૧૨૨૩૧૪૬/– (રૂપિયા બાર લાખ ત્રેવીસ હજાર એકસો છેતાલીસ પુરા) | અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂા. ૯૨૬૦૦/– (રૂપિયા બાધું હજાર છસ્સો પુરા) |
| શ્રી શ્યામજી રામકિશોર ચૌદ્યરી, શ્રીમતી માનસી શ્યામજી ચૌદ્યરી, મેસર્સ | ૧૧–૦૬–૨૦૨૪ રૂા. ૧૪૭૪૩૪૬/– (રૂપિયા શૌદ લાખ ચુંમોત્તેર હજાર ત્રણસો છેતાલીસ પુરા) | ફ્લેટ નં. ઇ-૪૧૦, ચોથો માળ, ઇ–બ્લોક, સોહાંગ હિલ્સ, મણિનગર, નારોલ, અમદાવાદ, ગુજરાત–૩૮૨૪૦૫ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. એરિયા | | રૂા. ૧૨૪૫૦૦૦/– (રૂપિચા બાર લાખ પીસ્તાલીસ હજાર પુરા) |
| શ્રી ગજાનંદ સર્વિસ | _ | ક્ષેત્રફળ(ચો.કુટમાં):મિલકતનો પ્રકાર: સીલેબલ એરિયા | | અર્નેસ્ટ મની કિપોઝીટ |
| (પ્રોસ્પેક્ટ નં. આઈએલ૧૦૨૫૭૨૦૧) | બિક વૃદ્ધિની રકમ રૂા. ૨૫૦૦૦/– (રૂપિયા પચ્ચીસ હજાર પુરા) | કાર્પેટ એરિયા મિલકત એરિયા: ૭૨૦.૦૦, ૪૩૬.૦૦ | રૂા. ૧૫૦૭૮૬૪/– (રૂપિયા પંદર લાખ સાત હજાર આઠસો ચોસઠ પુરા) | રૂા. ૧૨૪૫૦૦/– (રૂપિયા એક લાખ સોવીસ હજાર પાંચસો પુરા) |
| | અગત્થની માહિતી : આ હરાજી સરફૈર –૧૪ હેઠળ મેળવ્યા પછી અને જ્યારે ભૌ જરૂરી યોગ્ય ચકાસણી કરવાની રહેશે | ની એક્ટની કલમ ૧૩(૪) દ્વારા કબજાના ધોરણે પ્રસિદ્ધ કરાઈ તિક કબજો લેવામાં આવશે ત્યારે આપવામાં આવશે. બીડરે હ | છે. ભૌતિક કબજો સરફેસી એક્ટ રાજી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા દ | દેઠળ નિયત કાર્ચવાહી મુજબ કલમ સ્તાવેજો અને કાયદાકીય સંબંધિત |

૨૫-૦૭-૨૦૨૫ ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી ૨૮-૦૭-૨૦૨૫ ના રોજ સાંજે૫ વાગ્યા સુધી 3૦-૦૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી **ચુકવણીની પદ્ધતિ** : ઇએમડી ચુકવણીઓ ફક્ત ઓનલાઇન પદ્ધતિથી કરી શકાર્યો. ચુકવણીઓ કરવા માટે https://www.iiflonehome.com ની મુલાકત લેવી અને ફક્ત મિલકત/સિક્ચોર્ડ મિલકતની માટે ઉપલબ્ધ લિંક મારફત ચુકવણી કરવી. **નોંધ** : દરેક મિલકત માટે ચુકવણી લિંક અલગ અલગ છે. ખાતરી કરો કે તમે જાહેર હરાજી દ્વારા ખરીદવા ઇચ્છો છો તેજ મિલકતની લિંકનો ઉપયોગ કરી રહ્યાં છો. બેલેન્સ પેમેન્ટ માટેન Login https://www.iiflonehome.com>My Bid >Pay Balance Amount.

ઇએમડીની છેલી તારીખ

શકતો અને નિયમો: ૧.ઈ-હરાગુમાં ભાગ લેવા માટે, રસ ધરાવતા બીડરોએ અગાઉથી સર્વિસ પ્રદાતા https://www.iiflonehome.com માં તેમની વિગતો રજીસ્ટર કરવી બરૂરી છે અને લોગીન એકાઉન્ટ, લોગીન આઇડી અને પાસવર્ડ બનાવવા બરૂરી છે. રસ ધરાવતા બીડરોએ ટેન્ડર ફોર્મ તેમજ ઇએમડીની ચુકવાશીની વિગતો, કેવાયસી અને પાનકાર્ડની નકલ ઉપર બણાવેલ શાખા ઓફીસે બમા

કદલ વા ત્યુક કરા પ્રકાર છે. ૮. કોઇપણ મિલાત સંબંધિત પુછપરછ, મિલકતના નિરિક્ષણ અને ઓનલાઇન બીડ વગેરે માટે આઇઓઇએફએલ –એશએફએલ ટોલ ફ્રી નં. ૧૮૦૦ રદૃ૭ર ૪૬૯ ઉપર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૦૬:૩૦ વાગ્યાથી સાંજે ૧૮:૦૦ વાગ્યા સુધી કોલ કરવો અથવા ઇમેઇલ: auction.hl@jifl.com ઉપર લખો. ૯. આથી ઉપર ૧૦લાવેલ દેવાદારોને ઘરેલું સામાન જે ભીતક કબજે લેવા સમયે સિક્ચોર્ડ એશરેમાં હતો તે સાત દિવસની અંદર લઇ જવા જાણ કરવામાં આવે છે, નહીતર આઇઆઇએફએલ– એશએફએલ સંજોગોવસાત મિલકતના કોઇપણ નુકશાન માટે જવાળાદર ગણાશે નહી.

ર આવા કરવા સાતા કરવાના આવે છે. કે કાંગના વે ખાલા કે કરવાના સાહ્યા કારણના હતા તે તેના હતા હતા. હતા કરવાના આવે છ એએએકએલ સંજેગોવસાત મિલકતના કોઇપણ વૃક્ષાન માટે જવાબાદર ગણાશે નહી. ૧૦. દેવાદારોને વધુમાં નોટીસ આપવામાં આવે છે કે , ઉપર જ્યાવેલ વસ્તુઓ લેવામાં તેઓ નિષ્ફળ જશે તો, કાચદા અનુસાર વેચાણ કરવામાં આવશે. ૧૧. ઉપર જણાવેલ સમયગાળામાં સફળ બીડર/હરાજી ખરીદાર દ્વારા કોઇપણ સ્તરે કસુરના કિસ્સામાં, વેચાણ રદ કરવામાં આવશે અને પહેલેથી ચુકવેલ રકમ (ઇએમડી સહીત) જા. કરવામાં

. ઇપદ જાવાવા સનવન્યાના દાઇન અનુકાર્યાએ તાલી. વાજે અને મિલકનનું કરી તેશાઇ કરવામાં આવશે. . અધિકૃત અધિકારી કોઇપણ કારણ જણાવ્યા વગર ટેન્ડર/હરાજીની શરતો અને નિયમોમાં કેટફાર કરવાનો અથવા મોકુક/ રદ કરવાનો હક અનામત રાખે છે. ટેન્ડર/હરાજીમાં કોઇપણ વાદના કિસ્સામાં, આઇઆઇએફએલ-એસએફએલના અધિકૃત અધિકારનો નિર્ણય અંતિમ ગણાશે.

સરફૈસી એક્ટ, ૨૦૦૨ ના નિયમ ૯ ના પેટા નિયમ (૧) હેઠળ ૧૫ દિવસીય વેચાણ નોટીસ

આથી દેવાદારોને ટેન્ડરની તારીખ/હરોંજી પહેલા ઉપર જણાવેલ રકમ તેમજ અંતિમ તારીખ સુધી ત્યાજ અને આકસ્મીક ખર્ચ યુકવવા જણાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં હરાજી અને વેચાણ કરવામાં આવશે અને બાકી રકમ જો કોઇ હોય તો ત્યાજઅને ખર્ચ સહીત વસુલવામાં આવશે. સહી/– અદિકૃત અદિકારી, આઇઆઇએફએલ હોમ ફાચનાન્સ લીમીટેડ સ્થળ : ગુજરાત, તારીખ : ૧૦.૦૭.૨૦૨૫

muthööt

. වශයෙන් ශිරිනගන් යාවස

મુથુટ હાઉસિંગ ફાચનાન્સ કંપની લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : ટીસી નં ૧૪/૨૦૭૪–૭, મુથુટ સેન્ટર, પુણેણ રોડ, થિરાવંતપુરમ–૬૯૫ ૦૩૪, કોર્પોરેટ ઓફીસ : ૧૨/એ ૦૧, ૧૩મો માળ, પરીની ક્રેસકેન્ઝો, પ્લોટ નં. સી૩૮ અને સી૩૯, બાંદ્રા ફુર્લા કોમ્પલેક્ષ-જી

બ્લોક (પુર્વ), મુંબઇ–૪૦૦ ૦૫૧ ઇમેઇલ આઇડી : authorised.officer@muthoot.com માંગણા નોટીસ

સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ

જત જણાવવાનું કે મુચુટ હાઉસિંગ ફાયનાન્સ કંપની લીમીટેડ (એમએચએફસીએલ) ના નીચે સહી કરનાર ઝધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇગેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમે ૨૦૦૨ ના નિયમ ક સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલ દેવાદાર, સહ–દેવાદાર(૨ો), જામીનદાર(૨ો) ને જણાવેલ કાચદાની કલમ ૧૩(૨) હેઠળ માંગણ નોટીસ જારી કરી તેમને જારી કરાચેલ લાગતી વળગતી નોટીસોની તમોને વૈકલ્પિક બજવણીના માર્ગે અને સ્વરૂપે નીચે આપેલ નોટીસના પ્રકાશનની તારીખથી દૃદ હિલ્લાની એક્ટર લાગતી વળગતી જોટીસમાં જ્ણાવેલ પુરેપુરી બાકી સ્કમ તેમજ ઍતિમ તારીખ સુધીના વ્યાગ, કોસ્ટ અને ચાર્જ સહીત સુકવી જવા માટે જણાવામાં આ છે. લોનની પરત ચુકવણીઓની સિક્ચોરીટી તરીકે નીચે જ્ણાવેલ સિક્ચોર્ડ મિલકત(તો) જ્ણાવેલ દેવાદાર(રો), સહ–દેવાદાર(રો), જમીનદાર(રો) દ્વારા અનુકર્ય

| એમ | મેમએચએફસીએલને ગીરો કરાયેલ છે. | | | | | | | |
|-------------|---|------------------|----------------------------|---|--|--|--|--|
| ક્રમ નં. | દેવાદાર/સહ–દેવાદાર/ જામીનદારનું નામ | એનપીએની તારીખ | માંગણા નોટીસની તારીખ | કુલ બાકી લેણાંની રકમ | | | | |
| | લોન એકાઉન્ટ નં. ૧૬૧૦૦૮૦૯૨૩ ૧. મીનાબહાદુર ગોરેગુડા બુલ્લા ઉર્ફે મીનાબહાદુર ગોરેગુડા બુલ્લા, ૨. બેસાણા મીનાબહાદુર બુલ્લા | 29-06-2025 | 07-07-2025 | રૂ1. ૩૮૧.૦૦૧.૫૦/– (રૂપિયા ત્રણ લાખ એકચાંશી હજાર સાતસો એક અને પચ્ચાસ પૈસા પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ | | | | |

સિક્ચોર્ડ એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : ફ્લેટ નં. ૪૨૧, ચોથો માળ, ક્ષેત્રફળ આશરે ૩૮૩ ચો. ક્રુટ આશરે ૩૫.૫૮ ચો.મી., સુપર બિલ્ટ અપ એરિયા અને ૨૩૦.૪૩ ચો. ફુટ આશરે ૨૧.૪૧ ચો.મી. બિલ્ટ અપ એરિયા, તેમજ ૮.૦૦ ચો.મી. જમીનનો ન વહેંચાચેલ હિસ્સો, 'ટાઇમ સ્કવેર રેસિડેન્સી ઓફ વલભનગર', મુકામ–બ્લોક નં. ૧૨૧, ક્ષેત્રફળ ૧૯૦૮૭.૦૦ ચો.મી. પૈકી ૪૦ થી ૪૩ અને પ્લોટ નં. ૬૫ થી ૬૮, ક્ષેત્રફળ ૪૯૦.૯૬ ચો.મી., મોજે–ગામ–વારેલી, તાલુકો–પલસાણા, જિલો–સુરત ખાતેની સ્થાવર મિલકતન

| તમ | તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસામા : પુર્વ : સાસાચટાના રાડ, પશ્ચિમ : પેસેજ, ઉત્તર : બિલ્ડાગ, દક્ષિણ : ફ લેટ ન. ૪૧૯ | | | | | |
|----|---|------------|------------|--|--|--|
| 5 | લોન એકાઉન્ટ નં. MHFLRESGAN000005004721 | | | રૂા. ૧૩૯૨૧૨૮.૩૨/– (રૂપિચા તેર લાખ | | |
| | ૧. બીનાબેન ભાવેશભાઇ પરમાર, | 29-06-2025 | 02-07-2025 | બાણું હજાર એક્સો અઠચાવીસ અને | | |
| | ૨. ભાવેશભાઇ માથુરભાઇ પરમાર | | | બત્રીસ પૈસા પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ | | |

સિક્ચોર્ડ એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : ફ્લેટ નં. ૪૦૫, ચોથો માળ, ક્ષેત્રફળ આશરે ૫૦.૭૯ ચો. ચાર્ડ આશરે ૪૨.૪૬ ચો.મી., કાર્પેટ એરિયા બાંધકામ મિલકત અને તેમજ ૧૦.૦૦ ચો.મી. તેમજ જમીનનો ન વહેંચાયેલ હિસ્સો, મુકામ-'સનરાઇઝ એપાર્ટમેન્ટ' તરીકે જાણીતી સ્કીમ, જમીનનો સિટી સર્વે નં. ૧૩૧૨ અને શિટ નં. ૨૫, કુલ ક્ષેત્રફળ ૩૫૭.૧૫ પૈકી આગળની બાજુનો રોડ એરિયા, ક્ષેત્રફળ ૩૦૦ ચો.મી., મોજે–ગામ–પેથાપુર, ગામ–પેથાપુર, તાલુકો–ગાંધીનગર, જિલો–ગાંધીનગર, જિલો–ગાંધીનગર અને રજીસ્ટ્રેશન પેટા જિલો–ગાંધીનગર ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા** : પુર્વ : નગરપાલિકા રોડ, પશ્ચિમ : કોમન પેસેજ, ઉત્તર : સીડીઓ, દક્ષિણ : ફ્લેટ નં. ૪૦૪

| | લોન એકાઉન્ટ નં. 11153090408 ૧. રાકેશકુમાર ચંદુભાઇ રાવલ ઉર્ફે રાકેશભાઇ | 29-06-2025 | 02-07-2025 | રૂા. ૪૯૬૯૭૨.૬૭/– (રૂપિયા ચાર લાખ છક્ષું હજાર નવસો બોત્તેર અને સડસઠ પૈસા |
|--|--|------------|------------|---|
| | ચંદુભાઇ રાવલ, ૨. સુમીનાબેન રાકેશભાઇ રાવલ | | | પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ |

સિક્ચોર્ડ એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : મિલકત નં. ૧૪૦/૧૧ અને ૧૪૦/૧૨, મુકામ–મોજે–બોરીજ, તાલુકો– ગાંધીનગર , જિલો–ગાંધીનગર , રજુસ્ટ્રેશન જિલો–ગાંધીનગર અને પેટા જિલો–ગાંધીનગર ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા : મિલકત નં. ૧૪૦/૧૧ :** પુર્વ : ખુલી જગ્યા, પશ્ચિમ : રોડ, ઉત્તર : નટુભાઇ રાવલનું ઘર, દક્ષિણ : મિલકત નં. ૧૪૦/૧૨, **ચતુઃસીમા : મિલકત નં. ૧૪૦/૧૨ :** પુર્વ : ખુલી જગ્યા, પશ્ચિમ : રોડ, ઉત્તર : મિલકત નં. ૧૪૦/૧૧, દક્ષિણ : રુખીબેન

| I | નારણભાઇનું ઘર | | | | | | | |
|---|--|--|------------|---|--|--|--|--|
| | ૪ લોન એકાઉન્ટ નં. 11156089924 ૧. પ્રવિણકુમાર કુંવરજી ઠાકોર, ૨. વીણાબેન પ્રવિણકુમાર ઠાકોર | | 02-07-2025 | રા. ૩૦૦૭૬૧.૬૪/– (રૂપિયા ત્રણ લાખ સાતસો એક્સઠ અને ચોસઠ પૈસા પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ | | | | |

સિક્ચોર્ડ **એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત** : મિલકત નં. ૯૭, ઠાકોર વાસ, ચંદનસર સીમ, તાલુકો–સિદ્ધપુર અને <u>જિ</u>લો– પાટણ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ દ્૨.૭૩ ચો.મી. **ચતુઃસીમા** : પુર્વ : ખુલો રોડ, પશ્ચિમ : ખુલો રોડ, ઉત્તર : કુંવરજી ધિરજ્જી ઠાકોરનું ઘર, દક્ષિણ : મધુજી કુંવરજી ઠાકોરનું ઘર.

| | 3 | | | 3 | | • | 3 - 3 | | 3 | | |
|---|-------|-------|-----------|------|-----|----|--------------|-------|--------|------------|---|
| | | | ટ નં. 165 | | |) | | | | | રૂા. ૫૫૭૭૯૬ .૩૪/– (રૂપિચા પાંચ લાખ |
| ı | ૧. મક | બુલ સ | લિમભાઇ | ખોખર | , | | | 29-00 | 6-2025 | 02-07-2025 | સત્તાવન હજાર સાતસો છટ્ટાં અને ચોત્રીસ |
| l | | | નું સલિમલ | | | | | | | | પૈસા પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ |
| ı | 3. સઉ | ામભાદ | ા દક્માદલ | ાભાઇ | ખોખ | ıε | | | | | 12.11 32.17 1 1.11 2.11 2.11 3.11 |

સિક્ચોર્ડ એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : મિલકતનું ક્ષેત્રફળ ૪૦.૭૫ ચો.મી., મુકામ–અમરેલી રેવન્યુ સર્વે નં. ૧૫૯ પૈકી નિધી પાર્ક પૈકી પ્લોટ નં. ૩૦ પૈકી, મુકામ–મોરબી ખાતેની સ્થાવર બાંધકામ રેસિડેન્સીચલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા **ચતુઃસીમા** : પૂર્વ : પ્લોટ નં. ૨૭, પશ્ચિમ : રોડ, ઉત્તર : પ્લોટ નં. ૩૦ પૈકી, દક્ષિણ : પ્લોટ નં. ૩૦ પૈકી

| • | • | , | | |
|---|---|------------|------------|--|
| ξ | લોન એકાઉન્ટ નં. 16500091688 | | | રૂા. ૬૩૮૧૮<i>૭.</i>૨૧/– (રૂપિચા છ લાખ |
| | ૧. શારિદશા માલુકશાહ સામદા, | 29-06-2025 | 04-07-2025 | આડત્રીસ હજાર એક્સો સીત્યાંસી અને |
| | ૨. ફકિર માલુકશાહ સિદીશાહ | | | એકવીસ પૈસા પુરા) ૦૨.૦૭.૨૦૨૫ મુજબ |

સિક્ચોર્ડ એસટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : એન.એ. પ્લોટ નં. ક્ષેત્રફળ ૭૦.૫૨ ચો.મી. આશરે ૭૫૮.૭૯ ચો. ફૂટ અને બાંધકામ ક્ષેત્રફળ આશરે ૫૯.૧૯ ચો.મી. આશરે દુ૩૬.૯૧ ચો. ફુટ, બ્લોક નં. છુ–૨, સેક્ટર નં. ૮, 'રામકૃષ્ણા નગર', તરીકે જાણીતો એરિયા, 'સામાકાંઠા એરિયા' અને મુકામ–સિટી સર્વે નં. ૧૦૬૫, શિટ નં. ૮૬ અને વોર્ડ નં. ૪, ગામ–મોરબી, જિદ્યો અને પેટા જિદ્યો– મોરબી, રાજ્ય–ગુજરાત ખાતેની, આદેશ નં. દૃદ્દ/૨૦૨૫ દ્વારા પ્રિન્સિપાલ સિનિચર જજ મોરબી ના આદેશ મારફત મધુકાશા સિદિશા સાહમાદરને વસીચત કરાચેલની માલિકીની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા** : પુર્વ : સિટી સર્વે નં. ૧૦૬૪ ની મિલકત, પશ્ચિમ : સિટી સર્વે નં. ૧૦૬૬ ની મિલક્ત, ઉત્તર : રોડ, દક્ષિણ : રોડ

જો જણાવેલ દેવાદારો ઉપર જણાવ્યા મુજબ એમએચએફ્સીએલની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો, એમએચએફ્સીએલ ઉપર જણાવેલ મિલકતોનો કબજો લેવા હકદાર બનશે અને કાચદા હેઠળ કંપનીને પ્રાપ્ત આવી અન્ય કાર્ચવાહી કરશે જેના જોખમો, ખર્ચ અને પરિણામો સંપૂર્ણપણે દેવાદારોના જોખમે રહેશે. જ્યાવેલ દેવાદાર(રો), સહ–દેવાદાર(રો) અને જામીનદાર(રો) ને સરફૈસી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ ૧૩ ની જોગવાદાઓ હેઠળ એમએચએફ્સીએલની આગોતરી મંજુરી વગર ઉપર જણાવેલ સિક્ચોર્ડ મિલકત(તો) નું વેચાણ, ભાડે અથવા અન્ય કોઇપણ રીતે તબદીલી કરવાની મનાઇ કરમાવામાં આવે છે.

સહી/- અધિકૃત અધિકારી, મુથુટ હાઉસિંગ ફાયનાન્સ કંપની લીમીટેડ વતી સ્થળ : ગુજરાત, તારીખ : ૧૦.૦૭.૨૦૨૫

જના સ્મોલ ફાચનાન્સ બેંક (શિડ્યુલ્ડ કોમર્સિયલ બેંક) <u>રજીસ્ટર્ડ ઓફીસ:</u> ધ ફેરવે, ગ્રાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં.૧૦/૧,૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, કોરમંગલા ઇનર રીંગ રોડ, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, ચલાઘટ્ટા, બેંગ્લોર–પદ્દ૦૦૭૧ <u>રીજનલ બ્રાન્ચ ઓફીસ</u> : ૨૦૮ થી ૨૧૩, બીજો માળ, સાંગરીલા આકેંડ, સારસ્વત બેંક ઉપર ૧૦૦ ફુટ આનંદ નગર રોડ, શ્ચામલ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫.

સુધારો

આ અખબારમાં ૨૬.૦૬.૨૦૨૫ ના રોજપ્રસિદ્ધ કરાયેલ ઇ–હરાજી નોટીંસ જોવા વિનંતી છે, જેમાં ક્રમ નં. ૮, અસલ દેવાદાર/સહ–દેવાદાર જામીનદારના નામ: **૧) સોની નિરંજન ભાઈ,** લોન એકાઉન્ટ નં. ૩૧૪૭૯૬૩૦૦૦૦૨૭૬ ના સંબંધમાં રીઝર્વ કિંમત રૂા. ૨૯,૯૭,૦૦૦/– (રૂપિયા ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર પુરા) ને બદલે **રૂા. ૨૯,૨૭,૦૦૦/– (રૂપિયા ઓગણત્રીસ લાખ સત્યાવીસ હજાર પુરા**) **વાચંવાની રહેશે.** અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) રૂા. ૨,૯૯,૭૦૦/– (રૂપિયા બે લાખ નવ્વાણ હજાર સાતસોને બદલે **રૂા. ૨,૯૨,૭૦૦ (રૂપિયા બે લાખ બાણું હજાર સાતસો પુરા)** વાંચવાની રહેશે અન્ય તમામ વિગતો ચથાવત રહેશે.

સહી/– અધિકૃત અધિકારી સ્થળ : અમદાવાદ તારીખ : ૧૦.૦૭.૨૦૨૫ જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી

જાહેર નોટીસ વ્હીકલોના સંબંધમાં હરાજી ચોજેલ છે. મિલકત લઘૃત્તમ

આ જાહેર જનતાને જાણ કરવા માટે છે કે કોટક મહિન્દ્રા બેંક લીમીટેડે નીચેજ ણાવેલ

| મેક અને મોડલ | રજીસ્ટ્રેશન નં. | મેન્યુફેક્સરીગ વર્ષ | રીઝર્વ કિંમત | સરનામું | સંપર્ક વિગતો |
|--|-----------------|--|--------------|--|----------------------------------|
| TATA LPT 3118/52 CO | HR74A5206 | 2014 | 1330415 | | |
| CB_BOLERO PIK UP all Varients | GJ06BV3843 | 2023 | 633100 | કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ, | |
| DOST_GOODS | GJ05CW5750 | 2024 | 774405 | બીજો માળ, સ્પેન્સર્સ મોલ, ગેંડા સર્કલ પાસે. ડો. વિક્રમ | ચેતન સુરવાકે– ૯૨૬૫૩ |
| CB_MARUTI_SUPCAR RY | GJ26U0863 | સારાભાઈ માર્ગ, સેન્ટર સ્કલે મોલ સામે, લડોદરા–3600 | | ૮૨૬૫૯ | |
| ALBADADOST | GJ18BV7993 | 2024 | 780000 | | |
| BOLLERO CAMPER | GJ27ED7225 | 2024 | 900000 | કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ, | |
| ALBADADOST | GJ31T6191 | 2023 | 696000 | આઠમો માળ, એ– વિંગ, વિવાન સ્ક્વેર, જોદંપુર ક્રોસ રોડ, સેટેલાઈટ– ૩૮૦૦૧૫ | સુનિલકુમાર બારોટ- ૯૦૯૯૯ ૮૭૭૮૨ |
| MarutiS SUPCARY CNG | GJ13AX3751 | 2024 | 597000 | | |
| TATAMOTORS TATAACEZIP | GJ36T8032 | 2017 | 171000 | કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ, નાથ એડીફીસ કોમ્પલેંગ, ચોથો માળ, ડો. ચાફ્રિક રોડ, જિજ્ઞા | દાવલ જોધી– ૮૦૯૭૮ ૩૫૩૭૮ |
| Mah M_BOL_CAM4 | GJ39T1488 | 2023 | 855000 | પંચાયત સામે, રાજકોટ- | |
| MAH MHMAXXCITY | GJ13AX2649 | 2023 | 682000 | 350009. | |
| ASHOK_LEY ECOMET1615 | GJ36X5033 | 2023 | 1620000 | | |
| Ashok Leyland 4825 | GJ06BV9797 | 2022 | 2964463 | | |
| EICHER_PRO_2118_F BV | GJ19Y9327 | 2024 | 2138607 | કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ, ૩જો માળ, કે.જી પોઈન્ટ, ઘોડ દોડ રોડ, સુરત, ૩૯૫૦૦૭. | આદિલ કાસદ ૯૮૨૫૦ ૨૬૨૯૨ |
| VOLVO EICHER - EICHER 1110HD G DSD | GJ-23-Y-1799 | 2015 | 916252 | કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ નાથ એડિફીસ કોમ્પલેસ, ચોથો માળ, ડો. ચાફિક રોડ, જિદ્ઘા પંચાયત સામે, રાજકોટ– ૩૬૦૦૦૧ | યતિનકુમાર પટેલ ૯૭૨૭૭ ૮૮૬૧૯ |

મેસર્સ કોટક મહિન્દ્રા બેંક માં હાચપોથીકેશન હેઠળ "જ્યાં છે ત્યાંના ધોરણે"વેચાણ હેઠળ છે.

ઇચ્છુક વ્યક્તિઓ આ અખબારી પ્રકાશનથી ૭ દિવસની અંદર એટલે કેસ ૧૭.૦૭.૨૦૨૫ના રોજ અથવા એ પહેલા તેમના ક્વોટેશન્સ (ઓનલાઈન/ઓક્લાઈન) આપી શકે છે.

B _{FINSERV} બજાજ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ

કોર્પોરેટ ઓકીસ : કેરેબ્રુમ આઇટી પાર્ક બીર બિલ્ડીંગ પાંચમો માળ, કલ્ચાણી નગર, પૂણે, મહારાષ્ટ્ર-૪૧૧૦૧૪ **ાખા ઓફીસ** : પહેલો માળ, શ્રી બિલ્ડીંગ, મિસ્ટર <mark>પ</mark>ફ ઉપર, એક્સિસ બેંક સામે, હાલોલ ગોધરા રોડ, હાલોલ-પહેલો માળ, રુદ્રા સેમ્બર, ડૉ. ગીરધર પટેલ માર્ગ, બસ સ્ટેન્ડ પાસે, પાલનપુર **શાખા ઓફીસ** : ભાનુ પલાઝા, બીજો માળ, ન્યુ બસ સ્ટેન્ડ પાસે, સનાળા રોડ, મોરળી-૩૬૩૬૪૧. **શાખા ઓફીસ** : પહેલો માળ, ક્રિષ્ના ચેમ્બર બી એસબીઆઇ બેંક ઉપર, રેલ્વે સ્ટેશન રોડ, ભુજ-૩૭૦૦૦૧ **શાખા ઓફીસ** :ચોથો માળ, ઔરમ એવન્યુ, મેચર બંગલોઝ સામે, લો ગાર્ડન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-૮૦૦૦૬ <mark>શાખા ઓફીસ :</mark> સોથો માળ, આરકે પ્લાઝા, ૪૦૯–૪૧૦, આર.કે. પ્લાઝા, દિવાલીપુરા, વડોદરા–૩૯૦૦૦૭ **શાખા ઓફીસ** : પહેલો માળ, રાજકમલ સિટી મોલ નારા બેંક ઉપર, અમદાવાદ પાલનપુર હાઇવે રોડ, મહેસાણા–૩૮૪૦૦૧, **શાખા ઓફીસ** : પહેલો માળ, પરીખ ચેમ્બર, કોટક મહિન્દ્રા બેંકપાસે, રાજક્યલ ચોક, અમરેલી ૩૬૫૬૦૧, **શાખા ઓફીસ** : પહેલો માળ, પ્રણવ કોમ્પેલક્ષ, વોડાફોન ઉપર, મિલન ટોકીઝ રોડ, સુરેન્દ્રનગર–૩૬૩૦૦૨

કબજા નોટીસ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૦૨ ની કલમ ૧૩(૪) હેઠળ. સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦

ra જણાવવાનું કે મેસર્સ બજાજ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (બીએચએફએલ) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શ ઓફ કાયનાબ્સિયલ એસેટસ અને એન્કોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિય ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ દેવાદાર(રો)/સહ–દેવાદારો/જામીનદાર(રો) ને નોટીસમાં જણાવેલ રકમ જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જ્યાવ્યું હતું. દેવાદાર(રો)/સ૯-દેવાદારો/જામીનદાર(રો) રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે પરિણામે દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામીનદાર(રો) અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે મેસર્સ બજાજ હાઉસિંગ કાચનાન્સ લીમીટેડના વતી નીરં સહી કરનારે સદરહું નિયમોના નિયમ ૮(૧) સાથે વંચાતા સદરહું કાયદાની કલમ ૧૩(૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજ તાળી લીધો છે. પાર્રેણામે ખાસ કરીને દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામીનદાર(રો) અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે સોદો ન કરવા સાવધ કરવા?

આવે છે અને જણાવેલ મિલકત સાથેનો કોઇપણ સોદો બીએચએફએલની અહીં નીચે જણાવેલ ૨૬મ(મો) અને તેના પરના ચડત વ્યાજના પ્રથમ ચાર્જને આદિાન રહેશે

| દેવાદાર(રો)/જામીનદાર(રો) નું નામ (લોન એકાઉન્ટ નંબર, શાખાનું નામ) | | સિક્ચોર્ડ મિલકત (સ્થાવર મિલકતની) ની વિગત | માંગણા નોટીસની તારીખ અને રકમ | કળજાની તારીખ |
|---|--|---|---|-----------------|
| શાખા : લુનાવાલા લોન નં. : 7A7RMS83070606 ૧. અલ્કેશકુમાર કંચનલાલ કાછિયા (દેવાદાર) ૨. એતનકુમાર કંચનલાલ કાછિયા (સલ-દેવાદાર) બંનેનું સરનામું: ૨–૬૫૨–કે, છપૈયાગામ, લુનાવાડા– ૩૮૯૨૩૦ શાખા : અમદાવાદ લોન નં. : H418FLP0341255 ૧. આત્મીક ચિરાગભાઇ અદાણી એચયુએફ (દેવાદાર) સરનામું : કાંકરીયા, સુમેલ બિઝનેસ પાર્ક, વાણીજ્ય ભ અમદાવાદ, ગુજરાલ–૩૮૦૦૦૮ | સીટી સર્વે નં. ૧ ચો.મી, વોર્ડ નં લુણાવાડા, જિ બિન ખેતીલાર પશ્ચિમ: ખાનગં ખાનગી પ્લોટન તુન પાસે, | -ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા : ૧૬૫, ૧૫૨ પૈકી ખાનગી પ્લોટ નં. ૯૪, ક્ષેત્રફળ ૬૦.૦૦ . ૬, મ્યુન્સીપલ મિલકત નં. ૪૪૮/૫/૩૮૬, ગામ તાલુકો ઢો મહીસાગર, લુણાવાડા, ગુજરાત-૩૮૯૧૩૦ ખાતેની થક મિલકતના તમામ ભાગ અને હિસ્સા. પુર્વ:સેડ, ઊ પ્લોટનં. ૯૮, ઉત્તર: ખાનગી પ્લોટ નં. ૯૩, દક્ષિણ: તં. ૧૯૫ નીચેની બિન-ખેતીલાયક મિલકતના તમામ ભાગ અ હિસ્સા : ફ્લેટ નં. ૧૦૧, પહેલો માળ, 'વસુંઘ એપાર્ટમેન્ટ' તરીકે જાણીતી સ્કીમ, પ્રીતમનગર અખા પાછળ, એ ફપી નં. ૭૮૪, ટીપી સ્કીમ નં. ૩/૫, એસપી ન | રા રૂા. ૬૮,૦૧,૫૨૪ ડા (રૂપિયા ઝડ્સઠ નં. લાખ એક હજાર | os-os-sr |
| ર. શિરાગ શાર્હ (સ્વર્ગસ્થના કાનુની વારસદાર) (સહ-દેવાદાર), 3. આત્મીક અદાણી (સહ-દેવાદાર), સરનામું : ૧૦૧, તસુંધરા એપાર્ટમેન્ટ, પ્રીતમનગર અખાડા પાછળ, પાલડી, પ્રીતમનગર અખાડા પાછળ, પાલડી, અમદાવાદ, ગુજરાત– 3૮૦૦૦૭ | | ૧૨, મોજે-સાડાવડ, પાલડી, અમદાવાદ. પુર્વ : ફ્લેટ ૰ ૧૦૨, પશ્ચિમ : ચંદ્રપ્રભુ સોસાચટી પસીનું માર્જીન, ઉત્તર રોડ પછીનું માર્જીન જગ્યા, દક્ષિણ : ફ્લેટ નં. ૧૦૪, પેસે અને લિફ્ટ | ત. :: પુરા) | |
| શાખા : બરોડા | | ન–ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા : | | ૦૪–૦૭–૨૫ |
| 13HLT1122351 દાવલકુમાર જ્સભાઇ દરજી (દેવાદાર), ર. દેવીલાલ ભાઇ દરજી (સલ–દેવાદાર), સરનામું : ગ્રિપ્લેક્ષ ૬, મિલકતના ત | | ં, પરમ શ્રીન્સની, બ્લોક નં. ૪૪૬, જુના સર્વે નં. ફરફ , ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧, ફાઇનલ પ્લોટ નં. ૧૨૨, ાન એરિયા ક્ષેત્રફળ આશરે ૧૨૦૦ ચો.કુટ ધરાવતી ત્રી ગામ બિલ તાલુકો અને જિજ્ઞો વડીદરા ખાતેની તમામ ભાગ અને હિસ્સા. પુર્વઃ પ્લોટ નં. ૧૦, પશ્ચિમ: પાર્રિન જગ્યા પછી, ઉત્તરઃ માર્જિન જગ્યા, દક્ષિણ: ૭.૫ ચટીનો રોડ | (રૂપિયા છેત્તાલીસ લાખ ઓગણ્યસીતેર હજાર સાતસો ચૌદ | |

| શાખા : બરોડા | | નીચેની બિન–ખેતીલાચક મિલકતના તમામ ભાગ અને હિસ્સા : | ૨૮.૦૩.૨૦૨૫ | ૦૪–૦૭–૨૫ |
|--|--|---|--|----------|
| લોન નં. : H413HLD1093059 & | | યુનિટ નં. ૯, પરમ ગ્રીન્સની, બ્લોક નં. ૪૪૯, જુનો સર્વે નં. ૬૩૬ | ३ ।. ४६,६ ૯, ७ ९ ४ | |
| H413HLT1122351 ૧. દોવલકુમાર જસભાઇ દરજી (દેવાદાર), જશભાઇ દરજી (સહ–દેવાદાર), સરનામું : પરમ ગ્રીન્સ બીલ કેનાલ રોડ પાછળ, અલ પાસે, ટીપી ૧ બિલ, વડોદરા, ગુજરાત–૩૯૧ પાસે, ટીપી ૧ બિલ, વડોદરા, ગુજરાત–૩૯૧ | . ૨. દેવીલાલ ત્રિપ્લેક્ષ ૯, દોન બ્લુસ | ઝને દુ૩૩/૧, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧, ફાઈનલ પ્લોટ નં. ૧૨૨, ત્લોટ+ કોમન એરિચા ક્ષેત્રફળ આશરે ૧૨૦૦ ચો.ફુટ ધરાવતી ૪મીન પરની ગામ બિલ તાલુકો અને જિજ્ઞો વડોદરા ખાતેની મેલકતના તમામ ભાગ અને હિસ્સા. પુર્વઃ પ્લોટ નં. ૧૦, પશ્ચિમઃ ત્લોટ નં.૮ માર્જિન જગ્ચા પછી, ઉત્તરઃ માર્જિન જગ્ચા, દક્ષિણ: ૭.૫ મીટર સોસાચટીનો રોડ | (રૂપિયા છેત્તાલીસ લાખ ઓગણ્યસીતેર હજાર સાતસો ચૌદ પુરા) | |
| શાખા : મોરળી | | નીચેની બિન-ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને | PS-08.80-80 | ૦૪–૦૭–૨૫ |
| લોન નં. : H5E6FRL0342996 | | હિસ્સા : મુકામ–મોરબી, તાલુકો–ગામ–લાલપર, રેવન્થુ સર્વે | ₹I. ८,८४,६€€ | |
| ૧. નિલેષ લક્ષ્મણભાઇ વેરાવળિયા (દેવાદ | 12). | નં. ૫૦–બી, એન.એ. પ્લોટ નં. ૧, ખુલી જમીન ક્ષેત્રફળ ૬૩૫– | (રૂપિયા આઠ લાખ | I |
| ૨. વર્ષાબેન વેરાવળિયા (સહ-દેવાદાર), | તમામનં સરના | ૧૭ ચો.મી., બિલ્ટ અપ ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નં. ૭, બિલ્ટ અપ | ચોર્ચાસી હજાર છસ્સો | I |
| ૠષભ નગર રોડ નં. ૪, શ્રીજી પેલેસ પાસે | - | ું નુ આરવા ૨૨–૨૧૦ ચા.માં. અને ગ્રાઉન્ડ ક્લાર, શાવ ને. ૧૧. ૧ | નવ્વાણું પુરા) | |
| સામે, ગુજરાત હાઉસિંગ બોર્ડ રોડ, રાજકોટ | :, ગુજરાત–૩૬૩ | દુ૪૨ તમામ ભાગ અને હિસ્સા. | | |
| શાખા : ભૂજ | | નીચેની બિન-ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા | 8505.80.80 | ૦૫–૦૭–૨૫ |
| લોન નં. : H5F1FRL0341153 | | : પહેલો ફ્લેટ નં. સી એફસી, પી નં. દ્ર, રેવન્યુ સર્વે નં. ૯૮૦, નવો | ३ ।. ९ ९,८४,३२८ | |
| ૧. પ્રકાશ કાંતિલાલ શાહ (દેવાદાર), | | દાનશ્યામ નગર હેપી કોઝ, ભુજ, કચ્છ, પીન-૩૭૦૦૦૧ ભુજ, ગુજરાત-૩૭૦૦૦૧,પૂર્વ ફ્લોટનં.૨૪,પશ્ચિમ:ફ્લેટનં.ડી,કોમન | (રૂપિયા અગીયાર | |
| ૨. ચેતના પ્રકાશ શાહ (સહ-દેવાદાર), ત | | દિવાલ, ઉત્તર : પ્લોટ નં. ૫. દક્ષિણ : કલેટનો દરવાજો અને કોમન | લાખ ચોર્ચાસી હજાર | |
| ૦૫ પહેલો માળ, હેપ્પી એપાર્ટમેન્ટ, ભુજ | | પેસેજ | ત્રણસો અઠ્યાવીસ | |
| દાનશ્યામ નગર ખત્રી ચકલા ભુજ, ગુ | જરાત-3૭૦૦૦૧ | | પુરા) | |
| શાખા : અમરેલી | | નીચેની બિન-ખેતીલાચક મિલકતના તમામ ભાગ અને હિસ્સા | ०४.०४.२०२५ | ૦૪–૦૭–૨૫ |
| લોન નં. : H4A9RLP0626673 | | : એસ્ટેટ રેવન્યુ સર્વે નં. ૩૯૩/૧, પ્લોટ નં. ૧૩, કુલ ક્ષેત્રફળ ૪૦– | રૂા. ૫,૮૪,૮૨૪ | |
| ૧. પ્રતિક ભુપતભાઇ રાઠોડ (દેવાદાર), | | ૭૬ ચો.મી., મુકામ–કુંડલા તાલુકો–સાંવરકુંડલા, જિલો–અમરેલી | (રૂપિયા પાંચ લાખ | |
| ૨. ઉષાળેન ભૂપતભાઇ રાઠોડ (સહ–દે | વાદા૨), તમામ | ખાતેની સ્થાવર રેસિડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને | ચોર્ચાસી હજાર | |
| સરનામું : નાગનાથ સોસાયટી, હાથર | લણી રોડ, આ | ું હિસ્સા. પુર્વ : પ્લોટ નં. ૧૨, પશ્ચિમ : પ્લોટ નં. ૧૪, ઉત્તર : રોડ, | આઠસો ચોવીસ પુરા) | |
| | ગુજરાત–૩૬૪૫૧ | ા દાસણ : પ્લાટ ન. ૦૬ | | |
| શાખા : મહેસાણા | નીરોની બિન-પ | ા મેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા : (૧)ગ્રામ પંચાયત | ०४.०४.२०२५ | ૦૭–૦૭–૨૫ |

મિલકતનં. ૯/૧૯૧, એસેસમેન્ટ સીરીયલ નં. ૧૭૮૯, ચારેડી નવુ પરુ નાયક વાસ ત્રોન નં. : H496HLD0568635 & રૂા. ૧૭,૭૩,૭૭૫ ગામતલ), ક્ષેત્રફળ દ્૨.૭૩ ચો.મી.,(૨) ગ્રામ પંચાયત મિલકતનં. ૯/૧૮૩, ક્ષેત્રફળ 496HLT0592733 (રૂપિયા સત્તર લાખ દ્દર.૭૩ ચો.મી.,કુલ બંને મિલકતો ૧૨૫.૪૬ ચો.મી., મોજે જગુદાન, તાલુકો અને જિલો ા. રમેશ તખાજી ઠાકોર (દેવાદાર), ૨. મહેસાણા ખાતેની મિલકતના તમામ હક, ટાઈટલ અને હિત. ષાબેન રમેશભાઇ ઠાકોર (સહ-પંચોતેર પુરા) દેવાદાર), સરનામું : ગામ-જગૃદણ, વામીનરાયણ મંદિર પાસે, મહેસાણા, ોસ્ડાય-૩૮૮જી૦ ાખા : સુરેન્દ્રનગર **નીરોની બિન-ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા** : ફ્લેટ નં. ૫૦૪, 06-00-51 પાંચમો માળ, મહાવીર ફ્લેટ તરીકે જાણીતી સ્કીમ, જમીનનો પ્લોટ નં. ૨ પૈકી વઢવાણ લોન નં. : H5J8HLT0285505 & ३।. २०,३२,६४३ સિટી સર્વે નં. ૨૦૧ પૈકી વોર્ડ નં. ૩ અને ઓ.પી. નં. ૭૭ અને ૧૯૦ પૈકી વઢવાણ ટીપી (રૂપિયા વીસ લાખ . શિવરાજસિંહ સુખદેવસિંહ જેઠવા સ્કીમ નં. ૧, વઢવાણ રેવન્યુ સર્વે નં. ૧૭૯૩ પૈકી, બત્રીસ હજાર દેવાદાર), ૨. જચકુંવરબા શિવરાજસિંહ છસ્સો તેત્તાલીસ મુકામ–મહાવીર સોસાચટી, તાલુકો–વઢવાણ, જિલો–સુરેન્દ્રનગર ખાતેની મિલક્તન

ામામ ભાગ અને હિસ્સા. પુર્વ : મંગળદાસ નગીનદાસની મિલકત, પશ્ચિમ : પેસેજ

અને ફ્લેટ નં. ૫૦૧, ઉત્તર : ભોગીલાલ મનસુખલાલની મિલક્ત, દક્ષિણ : સીડીઓ

લિક્ટ અને ક્લેટ નં. ૫૦૩

જેઠવા (સહ–દેવાદાર), સરનામું :

ξ3430

ત્રીનૈત્ર મેઇન રોડ, થાનગઢ, ગુજરાત-

પુરા)

ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ

રજાસ્ટર્ડ ઓકીસ : ૨૪૦૧, જેન, થિમ્માચા રોડ, (કેન્ટોનમેન્ટ), પને– ૪૧૧ ૦૦૧ કન્ઝચુમર ફાયનાન્સ ડિવિઝન : ન્યુ નં. ૩૪, જી.એન. ચેટ્ટી રોડ, ટી. નગર, ચેજ્ઞા–૬૦૦ ૦૧*૭*. રાજ્ય અથવા શાખા ઓફીસ : ઈન્ડસઈન્ડ બેંક, ૩જો માળ, બિઝનેશ એમ્પાયર-૫, ૧/૫ જગનાથ પ્લોટ કોર્નર, ચાફ્રિક રોડ, આરકેસી કોલેજ સામે, રાજકોટ-૩૬૦૦૦૧.

કબજા નોટીસ

(સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) હેઠળ) ખાર્થો મેસર્સ ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન *પ* રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (અલ પછી એક્ટ તરીકે દર્શાવેલ છે) હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (અહીં પર્છ નિચમો તરીકે દર્શાવેલ છે) ના નિચમ ૯ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપચોગ કરીને નીરે જ્યાવેલ દેવાદારો/જામીનદારોને નોટીસ જારી કરી જ્યાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદ

નોટીસમાં જણાવેલ રકમ ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો જણાવેલ ગાળા દરમિયાન જણાવેલ રકમ તેમજ ચડત વ્યાજની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે અહીં નીચે સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહં નીચે જણાવેલ મિલકતનો સાંકેતિક કબજો દેવાદારો/જામીનદારોના નામો સામે જણાવેલ તારીખે લઇ લીધો દે જ્યાવેલ મિલકતો સાથેનો કોઇપણ સોદો મેસર્સ ઇન્ડર્સઇન્ડ બેંક લીમીટેડની દેવાદારો સામે જ્યાવેલ રકમો *અ* આકરિમક ખર્ગ, કોસ્ટ, રાર્જિસ અને તેના પરના લ્યાજના ગાર્જને આદિન રહેશે. સિક્સોર્ડ મિલકતો પરત મેળવલ માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોગ્લામાં આવે છે

| ક્રમ નં. | દેવાદાર/જમીનદારનું નામ / લોન એગ્રીમેન્ટ નંબર | માંગણા નોટીસની તારીખ કબજાની તારીખ | બાકી રકમ |
|-------------|--|--|---|
| 1. | દેવાદાર : ૧. શ્રી વિશાલ ગ્રીપાઠી જે ભવનાથ ગ્રીપાઠીના પુત્ર સહ-દેવાદાર : શ્રીમતી પ્રીચા ગ્રીપાઠી જે વિશાલ ગ્રીપાઠીના પત્ની ૨. શ્રીમતી સાવિગી દેવી જે રવી શંકર માંડલના પત્ની લોન એગ્રીમેન્ટ નંબર : GJG05083M તારીખ સ્ટ.૧૨.૨૦૧૯ | રપ.૦૧.૨૦૨૫ કબજાની તારીખ ૦૮–૦૭–૨૦૨૫ | રૂા. ૮૦૫૬૭૮.૯૭/– (રૂપિયા આઠ લાખ પાંચ હજાર છસ્સો ઈઠોતેર અને સત્તાણું પૈસા પુરા) ૨૫.૦૧.૨૦૨૫ મુજબ તેના પરનું રાડત વ્યાજ |
| _ | | | |

ગીરો મિલકતની વિગત : પ્લોટ નં. 33/બી, ક્ષેત્રફળ આશરે ૪૫–૩૨ રો.મી., રેવન્યુ સર્વે નં. ૨૫૪/૧/પૈકી ૧, 'ગાયત્રી હોમ્સ રેસિડેન્સી' તરીકે જાણીતો એરિયા, મુકામ–ગામ-વર્ષામેડી, તાલુકો–અંજાર, જિલો–કચ્છ, સબ ૨જીસ્ટ્રેશન જિલો–અંજાર, ૨જીસ્ટ્રેશન જિલો–કચ્છ, રાજ્ય–ગુજરાત ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા **ચતુઃસીમા** : પુર્વ : સબ પ્લોટ નં. 33/સી, પશ્ચિમ : સબ પ્લોટ નં. 33/એ, ઉત્તર : સર્વે નં ૨૫૨, દક્ષિણ : ૯-૦૦ મીટરનો પહોળો રોડ

ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ વતી તારીખ : ૦૮.૦૭.૨૦૨૫ સ્થળ : ગુજરાત (અધિકૃત અધિકારી)

સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપની લીમીટેડ

CIN : L73100GJ2006PLC047837 **૨જીસ્ટર્ડ ઓફીસ** : પ્લોટ નં.૫ અને દૃ/૧, સાવલી, જી.આઇ.ડી.સી. એસ્ટેટ,

રાતાલી–વડીદરા હાઇવે, મંજુસર–૩૯૧૭૭૫, જિલો–વડીદરા, ગુજરાત ટેલી: +૯૧ ૦૨૬૬૭ ૬૬૬૮૦૦ કોર્પોરેટ ઓફીસ : ૧૭/બી, મહલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,

મહાકાળી કેન્સ રોડ, અંદોરી ઇસ્ટ, મુંબઇ-૪૦૦ ૦૯૩, મહારાષ્ટ્રા. ફો**ન** : +૯૧ ૨૨ દૃદુ૪૫ પદુ૪૫ ફેક્સ : +૯૧ ૨૨ દૃદુ૪૫ પદુ૮૫ વેબસાઇટ : www.sparc.life ઇમેઇલ : secretarial@sparcmai

૨૦મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની વીસમી (૨૦મી) વાર્ષિક સામાન્ય સભ

(એજીએમ) મંગળવાર, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સાંજે૦૪:૦૦ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) મારફત કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ) સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દારા જારી કરાયેલ લાગ પરિપત્રોની તમામ લાગ જોગાઈઓના અનપાલનમાં યોજાશે ર૦મી એજીએમની નોટીસ તેમજ નાણાંકિય વર્ષ, ૨૦૨૪–૨૫નો વાર્ષિક અહેવાલ તમામ સભ્યો જેમના ઇમેઇલ એડ્રેસો કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, એમયુએફ્જી ઇન્ટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ (આરટીએ)/ડિપોઝીટરીઓ પાસે નોંધાચેલ છે તેમને ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવશે. ડિમટીરીચલાઈઝ્ડ સ્વરપે શેર હોલ્ડીંગ ધરાવતા સભઅચોને તેમના ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો પાસે તેમના ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવા વિનંતી છે અને કીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યોને આરટીએની વેબસાઈટ nttps://web.in.mpms.mufg.com - ઉપર તેમના ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબરો રજીસ્ટર કરાવવા વિનંતી છે અને કોઈપણ સ્પષ્ટતાઓ માટે તમે આરટીઓનો rnt.helpdesk@in.mpms.mufg.com ઉપર સંપર્ક કરી શકો છો. ૨૦મી એજીએમની નોટીસ તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૪–૨૫ નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ https://sparc.life/ અને સ્ટોક એક્સરોન્જો એટલે કે બીએસર્ઇ લીમીટેડની વેબસાઈટ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સરોન્જ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.nseindia.com પર ઉપલબ્ધ રહેશે સભ્યોને રીમોટ ઈ–વોટીંગ મારફત ૨૦મી એજીએમની નોટીસમાં જ્યાવેલ કાર્યો પર રીમોટલ<mark>ી</mark> તેમના મત આપવાની તક મળશે. ડિમટીરીચલાઈઝ્ડ સ્વરૂપે, ભૌતિક સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યો અને જે સભ્યોએ તેમના ઈમેઈલ એડ્રેસો રજ઼સ્ટર્ડ કરાવેલ નથી તેવા સભ્યો માટે રીમોટ ઈ-વોટીંગની રીત એજાએની નોટીસમાં આપવામાં આવશે. ઈ-વોટીંગ માટેની સવલત પણ એજીએમમાં ઉપલબ્ધ રહેશે અને એજીએમમાં હાજર રહેનાર સભ્યો જેમણે રીમોટ ઈ–વોટીંગ દ્વારા તેમના મતો આપેલ નથી તેઓ સભામાં મત આપવા માટે હકદાર ગણાશે.

ખાસ નોંધ લેવી કે સેબી સરક્યુલર તારીખ ૧૦ જુન, ૨૦૨૪ અનુસાર, ફીઝીકલ સ્વરૂપે સિક્યોરીટી હોલ્કીંગ ધરાવતા સભ્યોએ તેમના કેવાયસી, તેમજપાન, સંપર્ક વિગતો, નોમિનેશ, બેંક એકાઉન્ટ વિગતો અને નમુનારૂપ સહી અપડેટ કરાવવા ફરજિયાત છે.

સન ફાર્મા એડવાન્સ્ડ રીસર્ચ કંપની લીમીટેડ વતી

સ્થળ : મુંબઇ તારીખ : ૦૯ જુલાઇ, ૨૦૨૫

કાજલ દામણિયા કંપની સેક્રેટરી અને કમ્પલાચન્સ અદિકારી આઈસીએસઆઈ મેમ્બરશીપ નં. ૨૯૭૬૪

આથી, જ**ના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ** (અગાઉ જનલટ્સી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ તરીકે જાણીતી) ના અધિકૃત અધિકારીએ,સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અન એન્સ્ટોસ્ટ્રોયેન્ડ / લિગમો ટુબ્બર વા લિગમ ર સારો વંગ 6ળ મળતી સત્તાનો ઉપયોગ કરીને દેવાદાર(રો)/સહ-દેવાદાર(રો) ને **માંગણાં નોટીસ જા**રી કરી દેવાદારોને તેમના લાગતા વળગતા નામ સામે જગાવેલ રકમ જગાવેલ નોટીસમાં જગાવ્યા મજબ લાગુ દરોએ તેના પરના વ્યાજ તેમજ ચુકવાશી અને / અથવા છુટકારાની તારીખ સુધી લદાયેલ ચુડત વ્યાજ, લાગુ આકસ્મિક ખર્ચ, પડતર ખર્ચ, ચાર્જ વગેરે સહીત જણાવેલ નોટીસો મળ્યાથી દ્દ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

| | 3 3-3- | | | | | | |
|----------|-----------------|--|--|--|--|--|--|
| 중મ 더. | લોન નંબર | દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર/ગીરવેદાર | ૧૩(૨) નોટીસની તારીખ / બાકી રકમ (રૂા. માં) ના રોજ | કબજાનો પ્રકાર અને તારીખ / સમય | | | |
| 9 | 34<000830000850 | ૧) પટેલ અંક્તિકુમાર, ૨) ચતુરભાઇ ધુલાભાઇ પટેલ | ૧૯/૦૪/૨૦૨૫ રૂા. ૫,૧૫,૧૯૯/– (રૂપિયા પાંચ લાખ પંદર હજાર એક્સો નવાણું પુરા) ૧૪/૦૪/૨૦૨૫ મુજબ | ૦૭/૦૭/૨૦૨૫ ૦૩:૨૫ પીએમ સાંકેતિક કબજો | | | |

સિક્ચોર્ડ મિલકતની વિગત : જ્મીન ક્ષેત્રફળ ૭૮૦.૦૦ ચો. ફુટ, અંતરોલી ચારણીચા (૨૮) ગ્રામ પંચાયત આકારણી પત્રક મિલક્ત નં. ૨૭૪૧ હાઉસ નં. ૧૧/૪૭/૧/એ (૬૦ ગુણ્યા ૧૩) મુકામ–ગામતળ જમીન, ગામ–આંતરોલી, તાલુકો–પેટા જિલો–કપડવંજ, જિલો–ખેડા ખાતેની મેલક્તના તમામ રાઇટ, ટાઇટલ અને હિત. **ચતુઃસીમા** : પુર્વ : અરવિંદભાઇનું ઘર, પશ્ચિમ રોડ, ઉત્તર : પ્રફુલભાઇની જમીન, દક્ષિણ : અંકિતભાઇની મિલકત.

| ૧) મલેક ઝાહિરમીયાં અળ્ળાસમીયાં, ૨) મલેક અળ્ળાસમીયાં ઝાહિરમીયાં | 21 2 02 4011/ | ૦૭/૦૭/૨૦૨૫ ૦૩:૪૫ પીએમ સાંકેતિક કબજો |
|---|---------------|--|
|---|---------------|--|

સિક્ચોર્ડ મિલકતની વિગત : જિલો–ખેડા, પેટા જિલો–કપડવંજ્ય, મોજે–ગામ–દસાલવાડા, ગ્રામ પંચાયત મિલકત નં. ૩૦૯. ક્ષેત્રકળ એરિયા ૭૨૦.૦૦ રો. કટ. (૪૦ ગણ્યા ૧૮) **યતઃસીમા** પૂર્વ : પરવતભાઇ રાઇજીભાઇનું ઘર, પશ્ચિમ : રોડ, ઉત્તર : હબિબમીયાં દોસમીયાંનું ઘર દક્ષિણ : ઉમરાવમીચાં જીવામીચાંનું ઘર

| 3 | 39826890000904 , 3982689000032 | મનોજભાઇ, ૨) બોરાણા મનોજભાઇ રામજીભાઇ, ૩) બોરાણા નિતાબેન મનોજભાઇ | 31 .0 03 269/- | ૦૭/૦૭/૨૦૨૫ ૦૫:૫૧ પીએમ સાંકેતિક કબજો | ı |
|---|--------------------------------------|--|----------------|--|---|
|---|--------------------------------------|--|----------------|--|---|

સિક્ચોર્ડ મિલકતની વિગત : જમીન ક્ષેત્રફળ ૧૪૭.૬૧ ચો.મી., રાજ્સીતાપુર ગ્રામ પંચાયત આકારણી પત્રક મિલકત નં. ૫૦૧ નું હાઉસ, મુકામ–ગામતળ જમીન, ગામ–રાજ્સીતાપુર તાલુકો–ધ્રાંગ્રધ્રાં, જિલો–સુરેન્દ્રનગર, રાજ્સીતાપુર ગ્રામ પંચાયતની સીમા ખાતેની મિલકત **ચતુઃસીમા** : ઉત્તર : લલિતભાઇ મગનભાઇ મિસ્ત્રીનું ઘર, દક્ષિણ : હરપાલસિંહ પાથુભા શહોડના ઘર પછીનો રોડ, પુર્વ : મનુભાઇ શામજીભાઇ માણેકનું ઘર, પશ્ચિમ : પ્રેમજીભા ઓધવજીભાઇ મિસ્ત્રીનું ઘર

| 0 | 3 | | | 1 |
|--------------------------------------|--|--|--|---|
| 35x66x500033% , 35x66x60000553 | ૧) પરમાર વિશાભાઇ લખમણભાઇ, ૨) પરમાર રસિલાબેન વિશાભાઇ | ૧૬/૦૪/૨૦૨૫ રૂા. ૧૩,૯૮,૯૧૨/– (રૂપિયા તેર લાખ અહાણું હજાર નવસો બાર પુરા) ૧૪/૦૪/૨૦૨૫ મુજબ | ૦૮/૦૭/૨૦૨૫ ૧૨:૩૦ પીએમ સાંકેતિક કબજો | |

સિક્યોર્ડ મિલકતની વિગત : બ્લોક નં. કે-૨, જમીનનો ક્ષેત્રફળ ૪૩.૬૮ ચો.મી. પ્લોટ નં. ૧૫ પૈકી અને ૧૬ પૈકી પીપળી રેવન્ચુ સર્વે નં. ૮/૧ , મુકામ–'માનસ ધામ–૨' તાલુકો અને જિલો મોરબી ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા** : ઉત્તર : બ્લોક નં. કે–૩, દક્ષિણ : બ્લોક નં. કે–૧, પુર્વ : બ્લોક નં. એલ–૬, પશ્ચિમ : એન.એ. રોડ

અહીં ઉપર જ્યાવેલ દેવાદારો / સહ–દેવાદારો / જામીનદારો / ગીરવેદારો બાકી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ખાસ કરીને ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે જના સ્મોલ કાચનાન્સ બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ જણવેલ નિયમોન નિચમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ઉપર જણાવેલ તારીખોએ અહી ઉપર જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટોનો **કબજો** લઇ લીધો છે. ખાસ કરીને અહી ઉપર જણાવેલ દેવાદારો / જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આથી ઉપર જ્યાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જ્યાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે કોઇપણ સોદો જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના ચાર્જને આદ્યિન ૨હેશે.

સ્થળ : અમદાવાદ સહી/– અધિકૃત અધિકારી જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી તારીખ : ૧૦.૦૭.૨૦૨૫

જના સ્મોલ ફાયનાન્સ બેંક (શિક્યુલ્ડ કોમસિંચલ બેંક)

<u>રજીસ્ટર્ડ ઓફીસ:</u> ધ ફેરવે, ગ્રાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં. ૧૦/૧, ૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, કોરમંગલા ઇનર રીંગ રોડ, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, ચલાઘટ્ટા, બેંગ્લોર–પદ્દ૦૦૭૧ <u>રીજનલ બ્રાન્ય ઓફીસ</u> : ૨૦૮ થી ૨૧૩, બીજો માળ, સાંગરીલા આર્કેડ, સારસ્વત બેંક ઉપર, ૧૦૦ કૂટ આનંદ નગર રોડ, શ્યામલ, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૧૫.

Responsible Cars*



Kotak Mahindra Bank Limited

CIN - L65110MH1985PLC038137

Registered Office: 27BKC, C 27, G Block, Bandra Kurla Complex. Bandra (E), Mumbai - 400 051 Tel: +91-22-61660001, Fax: +91-22-6713 2403

Website: www.kotak.com, E-mail: KotakBank.Secretarial@kotak.com

NOTICE TO THE MEMBERS ABOUT THE FORTIETH ANNUAL GENERAL MEETING AND INFORMATION ON ELECTRONIC VOTING

The Fortieth Annual General Meeting ("AGM") of the members of Kotak Mahindra Bank Limited ("Bank") will be held on Saturday, 2nd August, 2025 at 10:00 a.m. (IST) through Video Conferencing ("VC"), in compliance with the provisions of the Companies Act, 2013 ("Act") and rules made thereunder read with relevant circulars issued by the Ministry of Corporate Affairs, to transact the business set out in the Notice of the AGM.

The Bank has availed services of National Securities Depository Limited ("NSDL") to provide the VC facility for conducting the AGM. Members may attend / access the AGM by following the steps mentioned for 'Access to NSDL e-Voting System', in the Notice of the AGM. After successful login, members will be able to see 'VC' link placed under 'Join Meeting' menu against the Bank's name in Shareholder / Member login of NSDL's website at www.evoting.nsdl.com Members participating through the VC facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

In compliance with the relevant circulars, the Notice of AGM and the Integrated Annual Report 2024-25, comprising the standalone and consolidated audited financial statements for the financial year ended 31st March, 2025, along with Directors' Report and Auditors' Report and other documents required to be annexed thereto, have been sent on 9th July, 2025 to the members of the Bank whose e-mail address is registered with the Bank / Registrar and Transfer Agent of the Bank / Depository Participants ("DP") (in case of demat holding). A letter providing the following QR Code and the web-link, giving the exact path on the Bank's website, where complete details of the Notice of AGM and the Integrated Annual Report 2024-25 are available, has also been sent to those members who have not registered their e-mail address:

| ocument | QR Code | |
|-------------------------------|---------|--------|
| Notice of AGM | | https: |
| ntegrated Annual Report | | https: |

Web-link ://www.kotak.com/content/dam/Kotak/ nvestor-relation/Financial-Result/ Annual-Reports/FY-2025/kotakmahindra-bank/agm-notice.pdf ://www.kotak.com/content/dam/Kotak/ nvestor-relation/Financial-Result/

Annual-Reports/FY-2025/

kotak-mahindra-bank/Kotak-Mahindra-2024-25 Bank-Limited-FY25.pdf The Notice of the AGM and the Integrated Annual Report are also available on the websites of the Stock Exchanges, namely, BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com,

respectively, and the website of the e-voting service provider, namely, Nationa

Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com The documents referred to in the Notice of the AGM are available for inspection through electronic mode, without any fee, by the members, from the date of circulation of this Notice up to the date of AGM. Members seeking to inspect such documents can send an e-mail to KotakBank.Secretarial@kotak.com Information and instructions for remote e-voting and e-voting during AGM:

- In accordance with the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), the MCA Circulars and Regulation 44 of the SEBI Listing Regulations read with the circular of SEBI on e-voting Facility provided by Listed Entities dated 9th December, 2020, Secretarial Standard on General Meetings (SS-2) and any amendments thereto, the Bank is providing remote e-voting facility to all its members to enable them to cast their vote on the matters listed in the Notice by electronic means and business will be transacted through such voting ("e-voting") The Bank has engaged the services of NSDL for providing e-voting facility to its Eligible members, enabling them to cast their vote electronically, in
- The manner of e-voting / logging in the AGM by (a) individual members holding equity shares of the Bank in demat mode, (b) members other than individuals holding equity shares of the Bank in demat mode, (c) members holding equity shares of the Bank in physical mode and (d) members who have not registered their e-mail address, is explained in instructions, as provided in the Notice of the AGM.
- The remote e-voting facility shall be available during the following period Commencement of remote e-voting: Tuesday, 29th July, 2025
- End of remote e-voting: Friday, 1st August, 2025 (till 5:00 p.m. IST) The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period.
- (iv) The facility for e-voting shall also be made available to those members who will be present in the AGM through VC facility and have not cast their vote through remote e-voting.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC but shall not be entitled to cast their vote again. Only a person whose name is recorded in the Register of Members or i
- the Register of Beneficial Owners maintained by the depositories as on Cut-off Date i.e., Saturday, 26th July, 2025, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. (vii) Voting rights of members shall be in proportion to their share in the
- paid-up equity share capital of the Bank as on the Cut-off Date, subject to applicable laws, including the Banking Regulation Act, 1949. (viii) Every Folio / Client ID will have only one login-ID irrespective of th
- number of joint holders. Any person who becomes a member of the Bank after the Notice is sent
- and holds shares as of the Cut-off date, i.e., Saturday, 26th July, 2025 may obtain the user ID and password for e-voting by sending a request at evoting@nsdl.com However, if such person is already registered with NSDL for remote e-voting, then such person may use the existing user ID and password for casting vote.
- If any member has forgotten the user ID and / or password, the same can be reset by using 'Forgot User Details / Password' or 'Physical User Reset Password' option available on www.evoting.nsdl.com

In case of any query / grievances related to the facility of remote e-voting voting by electronic means of if members need any assistance before or during the AGM, such member may refer to the Frequently Asked Questions ("FAQs") for members and e-voting user manual for members available in the download section of www.evoting.nsdl.com

PROCEDURE FOR (i) REGISTRATION OF E-MAIL ADDRESS FOR OBTAINING THE NOTICE OF AGM, INTEGRATED ANNUAL REPORT 2024-25 AND THE USER ID / PASSWORD FOR E-VOTING / ATTENDING THE AGM AND (ii) UPDATION OF BANK ACCOUNT MANDATE FOR RECEIPT OF DIVIDEND IS, AS BELOW:

| Type of Holding | Procedure |
|------------------|---|
| Physical Holding | For registration of e-mail address and / or updation of |
| | Bank Account details, please send a written request |
| | in Form ISR-1 (available at https://www.kotak.com/ |
| | en/investor-relations/investor-information/ |
| | investor-info.html) to the RTA of the Bank, i.e., KFin |
| | Technologies Limited at Selenium Tower B, Plot 31-32, |
| | Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad |
| | – 500 032 (Unit: Kotak Mahindra Bank Limited), providing |
| | Folio Number, name of the member, copy of the share |
| | certificate (front and back), PAN (self-attested copy of |
| | PAN card) and AADHAAR (self-attested copy of Aadhaar |
| | card). Additionally, please provide a self-attested copy of a |
| | cancelled cheque leaf bearing the name of the first holder |
| | / bank statement duly attested by the Bank Manager |
| | (along with the details of 9-digit MICR Code Number and |
| | 11-digit IFSC), for updating bank account details. |
| Demat Holding | Please contact your Depository Participant ("DP") and |
| | register your e-mail address and bank account details in |

your demat account, as per the process advised / forms made available by your DP.

For KOTAK MAHINDRA BANK LIMITED **Avan Doomasia Company Secretary** (FCS 3430) Mumbai, 9th July, 2025

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Navin Fluorine International Limited Regd. Office: Office No. 602, Natraj by Rustomjee, Near Western Express Highway, Sir Mathuradas Vasanji Road, Andheri (East), Mumbai 400069, India Tel. No. + 91 22 6650 9999 | Fax No. +91 22 6650 9800

Website: www.nfil.in | E-mail: investor.relations@nfil.in CIN: L24110MH1998PLC115499

THIS NOTICE is with reference to the Notice published on July 9, 2025 in the newspapers viz. Financial Express and Loksatta regarding the 27th Annual General Meeting ('AGM/Meeting') of the Company which is scheduled to be held on Thursday, July 31, 2025 at 3.00 p.m. (IST) through Video Conferencing ('VC')/Other Audio Visual Means ('OAVM'), to transact the Business Items as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with the rules made thereunder ('the Act') and General Circular of the Ministry of Corporate Affairs ('MCA') dated September 19, 2024 and other applicable General Circulars (collectively referred as 'MCA Circulars').

NOTICE

In accordance with the MCA Circulars and the relevant provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual Report for the financial year 2024-25, including the AGM Notice and e-voting instructions, has been sent electronically today i.e. on July 9, 2025, to all Members whose e-mail IDs are registered with the Company/the Company's Registrar and Share Transfer Agent viz. KFin Technologies Limited Depository Participants unless any Member has requested for a physical copy. A letter containing the web-link of the Annual Report has been sent to Members who have not registered their e-mail Ids. The Annual Report, including notice of AGM, is also available on the website of: 1) the Company at https://www.nfil.in/investor/annu_reports.html, 2) BSE Limited at www.bseindia.com, 3) National Stock Exchange of India Limited at www.nseindia.com and 4) National Securities Depository Limited ('NSDL') at www.evoting.nsdl.com.

> By order of the Board of Directors For Navin Fluorine International Limited

PADMANABH MAFATLAL GROUP

Niraj B. Mankad **President Legal & Company Secretary**

THE BUSINESS DAILY **FOR DAILY BUSINESS**

***FINANCIAL EXPRESS**



GUJARAT HOTELS LIMITED Website: www.gujarathotelsltd.in | E-mail: investors@gujarathotelsltd.com

Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2025

3 months Twelve Corresponding ended months ended 3 months ended **Particulars** 30.06.2025 31.03.2025 30.06.2024 (1) Total Income from Operations 186.39 744.75 145.08 (2) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 133.72 173.86 693.90 (3) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 133.72 173.86 693.90 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary 140.43 529.87 125.29 (5) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 140.43 529.87 125.29 (6) Equity Share Capital 378.75 378.75 378.75 (7) Reserves Excluding Revaluation Reserve 4,469.95 (8) Earnings Per Share (of ₹ 10/- each)

a) Basic (₹)

b) Diluted (₹)

a) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and this extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the meeting held on 9th July 2025. The full format of the Statement of Unaudited Financial Results are available on the Company's website (www.gujarathotelsltd.in) and on the website of the BSE Limited (www.bseindia.com).

3.71

3.71

The Limited Review, as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed and the related Report forwarded to the Stock Exchange. This Report does not have any impact on the above 'Results and Notes' for the Quarter ended 30th June, 2025 which needs to be explained.

Registered Office: WelcomHotel Vadodara, R.C.Dutt Road, Alkapuri, Vadodara-390007 **Date : 9th July 2025**

Place: New Delhi, India

For and on behalf of the Board Rishabh Punjabi **Anil Chadha Chief Financial Officer** Chairman

13.99

13.99

3.31

3.31

Phone: 0265-2330033 | Fax: 0265-2330050 | CIN: L55100GJ1982PLC005408

BENGAL & ASSAM COMPANY LIMITED NOTICE

Date: July 09, 2025

Place: Mumbai

Transfer of Equity Shares of the Company to IEPF

Shareholders are hereby informed that pursuant to Section 124 (6) of the Companies Act, 2013 read with amended Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("IEPF Rules"), all shares in respect of which dividend declared for the financial yea 2017-18 has not been paid or claimed by the Shareholders for 7 (Seven) consecutive years or more shall be transferred by the Company to the Investor Education and Protection Fund Authority (IEPF Authority).

Individuals notices has been sent to all the respective Shareholders at their latest available addresses in the Company's record interalia providing the details of shares liable to be transferred for taking appropriate action. The full details of such shareholders is available on the Company's website at www.bengalassam.com.

The concerned Shareholders are requested to claim the unclaimed dividend from the Company on or before 27th August, 2025 failing with which their shares shall be transferred to IEPF Authority without any further Notice. However, the Shareholders would be entitled to claim the shares from IEPF Authority by making an Application in Form IEPF-5, as prescribed under the IEPF Rules, which is available on IEPF website i.e. www.iepf.gov.in.

In case of any query related to IEPF, Shareholders may contact the Company at dswain@jkmail.com or ajay.tiwari@jkmail.com or RTA at ramap@alankit.com.

Shareholders may also note that, as mandated by SEBI, the Company had sent several Reminders to all the Shareholders holding shares in physical form, requesting them to furnish their KYC and other details in the prescribed Forms (ISR-1, 2, 3, SH-13 and 14, available on the website of the Company www.bengalassam.com) to the Company's Registrar and Share Transfer Agent (RTA). In case, you have not submitted the required details so far, we once again request you, in your own interest, to immediately send these details to our RTA at its Office at Alankit Assignments Limited, Alankit House, 4E/2, Jhandewalan Extension, New Delhi - 110055 or E-mail to ramap@alankit.com.



e vedanta

For Bengal & Assam Company Limited Dillip Kumar Swain Company Secretary

HINDUSTAN ZINC LIMITED

retarial@vedanta.co.in website: www.h Tel: +91.2946604000-02 CIN: L27204RJ1998PLC001208

PUBLIC NOTICE TO THE MEMBERS - 59" ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the fifty-ninth (59") Annual General Meeting ("AGM") of the Members of

the Company is scheduled to be held on Tuesday, August 05, 2025 at 12:00 Noon (IST) through Video

Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as set forth in

Pursuant to General Circular No. 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate

Affairs ("MCA") read together with other previous Circulars issued by MCA in this regard and Circular No.

SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by the Securities and Exchange

Board of India ("SEBI") read together with other previous Circulars issued by SEBI in this regard

(hereinafter collectively referred to as "the Circulars"), companies are allowed to convene the AGM

through VC or OAVM without physical presence of the Members at a common venue till September 30,

In accordance with the Circulars, the Company will send the Notice along with the Integrated Report and

Annual Accounts of the Company for FY 2025 ("Integrated Annual Report") electronically to all its

members whose e-mail IDs are registered with the Company/Depository Participants ("DPs"). A letter

providing the weblink, including the exact path for accessing the Integrated Annual Report for the

Members may note that the Integrated Annual Report and the Notice will be made available on the

website of the Company at www.hzlindia.com, the website of the Stock Exchanges, i.e., BSE Limited at

www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and also on the

Members holding shares in physical mode, who have not registered/updated their e-mail ID and who

wish to receive the Notice, Integrated Annual Report and all other communications by the Company,

from time to time, may get their e-mail IDs registered by submitting Form ISR-1 to KFin Technologies

Limited ("KFin"), the Registrar & Share Transfer Agent ("RTA") of the Company, at

einward.ris@kfintech.com or to the Company at hzl.secretarial@vedanta.co.in. However, for the shares

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated May 07, 2024, all the

Members holding shares in physical mode are mandatorily required to furnish/update their e-mail ID,

Mobile Number, PAN and other KYC details through Form ISR-1, to update specimen signature through

Form ISR-2, to furnish the Nomination as provided in Rule 19(1) of the Companies (Share Capital and

Debentures) Rules, 2014 through Form SH-13 or to opt out from giving the Nomination through Form

ISR-3 and to change the Nomination through Form SH-14. These forms are also available on the website

of the Company at KYC Forms | Hindustan Zinc (hzlindia.com). SEBI has mandated for all companies to

utilize the bank account details as furnished by the Depositories and as maintained by the RTA for

Members may note that, all security holders (holding securities in physical form), whose folio(s) do not

have PAN or Contact Details or Mobile Number or Bank Account Details or Specimen Signature updated,

shall be eligible for any payment including dividend, interest or redemption in respect of such folios, only through electronic mode with effect from April 01, 2024 and upon complying with the PAN, and KYC

requirements to enable the Members to receive the dividend at the earliest, the Members holding

shares in physical mode are requested to update their KYC details by submitting various ISR Forms to KFin as mentioned above. In accordance with the above, dividends, in respect of physical folios wherein

any of the KYC details are not updated, will be held back by the Company. Members may please note that the dividends will get credited to their bank account only after the KYC details are updated in the folio.

The Members can join and attend the AGM through VC/OAVM facility only or view the live webcast of the proceedings. The detailed procedure for e-voting and participation in the AGM through VC/OAVM

or to view the live webcast will be provided in the Notes to the Notice. The Members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast

their vote again. Those Members who participate in the AGM through VC/OAVM and have not casted

The above information is being issued for the information and benefit of all the members of the

Company and in compliance with the MCA and SEBI Circulars as amended from time to time.

Financial Year 2025 will be sent to all these members who have not registered their e-mail ID.

website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

held in demat mode, Members are requested to write to their respective DPs.

their vote through remote e-voting may cast their vote during the AGM.

payment of dividend electronically to Members.

Place: Delhi

the Notice convening the Meeting ("Notice") which would be circulated in due course of time.

2025. Accordingly, the AGM of the Company is being held through VC/OAVM.

Regd Office : Yashadgarh, Yashad Bhawan; UDAIPUR-313 004 (Rajasthan)

Corporate Identity Number: L67120WB1947PLC221402 Website: www.bengalassam.com, Email: dswain@jkmail.com Regd. Off.: 7, Council House Street, Kolkata - 700001, West Bengal Tel.: 033 - 22486181/22487084, Fax: 033 - 22481641

For Kind Attention of Shareholders: As a part of Green Initiative of the Government, all the Shareholders are requested to get their e-mail addresses registered with the Company, for receiving Annual Report etc. on e-mail.



SMS PHARMACEUTICALS LIMITED CIN: L24239AP1987PLC008066

Read. Office: Plot No. 72, H. No.: 8-2-334/3&4, Road No. 5 Opp. SBI Executive Enclave, Banjara Hills, Hyderabad, Telangana- 500034, Contact No. 040-35359999 / 2525 9999 Email:complianceofficer@smspharma.com, cs@smspharma.com | Web: www.smspharma.com

NOTICE TO SHAREHOLDERS - TRANSFER OF SHARES TO INVESTOR EDUCATION PROTECTION FUND (IEPF)

Notice is given pursuant to Section 124(6) of the Companies Act, 2013, read with Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as amended from time to time, providing for transfer of the Equity Shares to IEPF in respect of which the dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more to the IEPF Account established by the Central Government.

The unclaimed dividend for the year 2017-2018 and the shares in respect of which the dividend are unpaid/unclaimed for a period of seven consecutive years are due to be transferred to IEPF during the FY 2025-2026. A list of such shareholders, who have not encashed their dividends for seven consecutive years and whose shares are therefore liable for transfer to the IEPF account, is displayed on the website of the Company at www.smspharma.com under the section "Investors".

The Company has sent individual communication to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF account as per the said rules for taking appropriate action and submitting requisite documents to claim the shares and unpaid dividend amount(s) before its credit to the IEPF Account. In case the Company does not receive any communication from the concerned shareholders on or before October 05th, 2025, the Company shall with a view to complying with the requirements set out in the Rules, transfer the shares to the IEPF Account by the due date as per the procedure stipulated in the Rules.

Notice is further given that in the absence of receipt of a valid claim by the shareholder, the Company shall transfer the said shares to IEPF Account without further Notice in accordance to the requirements of the said rules, no claim shall lie against the Company or RTA. Please note that subsequent to such transfer, all future benefits which may accrue thereunder including future dividends, if any, will be credited to the IEPF.

Further, the shareholders may kindly note that after the above referred transfer is made refunds from the IEPF can be claimed only by complying with the provisions of Rule 7 of the IEPF Rules i.e., by submitting an online application in a prescribed web Form IEPF-5 available on the website: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html For any information / clarifications on this matter concerned shareholders may write to the Company at cs@smspharma.com or contact the Company's Registrar and Share

Transfer Agent - M/s. Aarthi Consultants Private Limited, # 1-2-285, Domalguda, Hyderabad, Telangana - 500029, Ph: 040-27638111, info@aarthiconsultants.com For SMS Pharmaceuticals Limited

Place: Hyderabad Date: 09.07.2025

HINDUSTAN ZINC

Thirumalesh Tumma Company Secretary

SUN PHARMA ADVANCED RESEARCH COMPANY LIMITED

CIN: L73100GJ2006PLC047837 Registered Office: Plot No. 5&6/1, Savli G.I.D.C. Estate, Savli - Vadodara Highway, Manjusar - 391775 Tel: +91 02667 666800 Corporate Office: 17/B, Mahai Industrial Estate, Mahakali

Caves Road, Andheri East, Mumbai 400 093, Maharashtra Tel: +91 22 6645 5645 Fax: +91 22 6645 5685 Website: www.sparc.life Email: secretarial@sparcmail.com

NOTICE OF 20™ ANNUAL GENERAL MEETING

This is to inform that the Twentieth (20") Annual General Meeting of the Members of the Company will be held on Tuesday, August 12, 2025 at 04:00 P.M. ("AGM") through Video Conferencing ("VC"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 read with enabling circulars issued by the Ministry of Corporate

The Notice of 20th AGM along with the Annual Report for the financial year 2024-25 will be sent by electronic mode to all the members whose email addresses are registered with the Company's Registrar and Transfer Agent, MUFG Intime India Private Limited ("RTA")/ Depositories. Members holding shares in dematerialized form are requested to register their email address and mobile number with their Depository Participants, and members holding shares in physical form are requested to register details of their email address and mobile number on the website of the RTA at https://web.in.mpms.mufg.com and for any clarification you may contact to RTA at rnt.helpdesk@in.mpms.mufg.com . The Notice of 20th AGM along with the Annual Report for the financial year 2024-25 shall also be available on the website of the Company at https://sparc.life/ and on the websites of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and the National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com. being the agency appointed by the Company for providing e-voting facility.

Members will have an opportunity to cast their votes remotely on the business as set forth in the Notice of the 20" AGM through remote e-voting. The manner of remote evoting for members holding shares in dematerialization form, physical form and members who have not registered their email addresses will be provided in the Notice of the AGM. The facility for e-voting will also be provided at the AGM, and members attending the AGM, who have not cast their votes by remote e-voting, will be able to vote at the meeting.

It is important to note that as per the SEBI circular dated 10th June 2024, members with securities held in physical form must update their KYC, including the PAN, Contact Details, Nomination, Bank Account Details, and Specimen Signature.

For Sun Pharma Advanced Research Company Limited Kajal Damania

Place: Mumbai Date : July 09, 2025

Company Secretary and Compliance Officer ICSI Membership No. 29764

2. Diluted : Rs.

Date: July 09, 2025

Place: Mumbai

UMIYA

UMIYA BUILDCON LIMITED

(Formerly MRO-TEK Realty Limited) Regd Office: No.6, 'Maruthi Complex', New BEL Road, Chikkamaranahalli, Bengaluru-560 054

Phone: 080-29911217 | Website: www.mro-tek.com | CIN NO.L28112KA1984PLC005873

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE **QUARTER ENDED 30TH JUNE, 2025**

Rs.in Lakhs CONSOLIDATED RESULTS Quarter Ended **Particulars** 30 June 2025 31 March 2025 31/Mar/2025 (Audited) 5.137.21 Total income from operations 5.415.69 1,372.90 2 Net Profit / (Loss) for the period before Tax, Exceptional and Extraordinary Items 3,855.78 67.65 749.86 3 Net Profit / (Loss) for the period before Tax, but after Exceptional and Extraordinary Items 3,855.78 749.86 4 Net Profit / (Loss) for the period after Tax, after Exceptional and Extraordinary Items 3,143.38 32.90 583.94 Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) 3,144.93 22.76 577.32 6 Equity Share Capital 934.23 934.23 934.23 9,703.34 6,558.38 6,558.38 8 Earnings Per Share (of Rs. 5/-each) for Continuing and discontinued Operations 1. Basic: Rs. 3.17 16.82 0.20

Key numbers of Unaudited Standalone Financial Results Quarter Ended Year Ended **Particulars** 31 March 2025 31/Mar/2025 30 June 2025 (Unaudited) (Audited) (Audited) 1 Turnover 5,234.36 5,211.06 1,467.63 2 Net Profit / (Loss) for the period before Tax 3,843.38 751.67 118.99 3 Net Profit / (Loss) for the period after Tax, 3,139.25 86.00 597.71 Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Reg. 33 of the SEBI (LODR) Regulations 2015. The full format of the Financial Results are available on the

vebsites of the Stock Exchanges www.bseindia.com and www.nseindia.com. website of the company, "www.mro-tek.com". Place : Bengaluru Date : 8th July 2025

For UMIYA BUILDCON LIMITED Aniruddha Mehta **Chairman and Managing Director**

16.82

0.20

3.17

NOTICE

Motilal Oswal Financial Services Limited SEBI Registration No.: INZ000158836

Member of Multi Commodity Exchange of India Limited (MCX); Member ID 55930, BSE Limited (BSE) Clearing No.: 446, National Stock Exchange of India Ltd (NSE) Member ID 10412 (NCDEX) ID 1240 Registered office Address of Member: Motifal Oswal Tower, Rahimtullah Sayani Road, Opposite Parel ST Depot, Prabhadevi, Mumbai - 400 025, Tel No.: 022-7193 4200.

This is to inform all concerned that we have initiated the process of cancellation of registration of our below mentioned Authorised Person (AP) due to regulatory reasons/concerns.

| Exchange | Name of AP | Trade Name of AP | Address of AP | AP Registration No. |
|----------|--------------------|------------------|---|---------------------|
| MCX | AMAN UMESH SONI | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST, THANE, MAHARASHTRA, INDIA, 421201. | MCX/AP/156333 |
| BSE | AMAN UMESH SONI | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST, THANE, MAHARASHTRA, INDIA, 421201. | AP01044601146987 |
| NSE | AMAN UMESH SONI | MAKEMONEYMORE | SHOP NO F/7, 1ST FLOOR, CHANDRESH VILLA, LODHA HEAVEN, NILJE, DOMBIVLI EAST, THANE, MAHARASHTRA, INDIA, 421201. | AP0297504931 |

Any person dealing with the above-mentioned Authorised Person henceforth shall do so at their own risk. Motilal Oswal Financial Services Limited shall not be liable for any dealings with the said entity post the issuance of this notice. Investors having any queries or concerns regarding this matter are requested to contact Motilal Oswal Financial Services

Limited within 15 days from the date of issuing this notice. For Motilal Oswal Financial Services Limited

Authorised Signatory

Ahmedabad

Aashhima V Khanna Date: July 10, 2025 Company Secretary and Compliance officer Membership No.: ACS 34517

epaper.financialexpress.com

For Hindustan Zinc Limited